

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

તારીખ : ૧૭ માર્ચ ૨૦૨૫, સોમવાર	વર્ષ : ૧૬	તંત્રી : પટેલ સુરેશ રમણલાલ	કિંમત : રૂા. ૨.૦૦
વિક્રમ સંવત ૨૦૮૧, ફાગણ વદ ૩	અંક : ૨૫૩	અમદાવાદ	પાના : ૮
ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૭૭૯-૨૬૭૬૫૭૩૩ e-mail : cnnngujarat@yahoo.com, cnnngujarat@gmail.com			
RNI Reg. No. GUJGUJ/2009/28886			

રમખાણોને લગતા આરોપો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, તે સમયે, અમારા રાજકીય વિરોધીઓ કેન્દ્રમાં સત્તામાં હતા

૨૨ વર્ષમાં ગુજરાતમાં એક પણ મોટો રમખાણ થયો નથી : પીએમ મોદી

ગોધરા ઘટનાનો ભયાનક બનાવ દરેક માટે દુઃખદ : વડાપ્રધાન મોદી

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । લેક્સ ફિડમેન પોડકાસ્ટ પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "તે સમયે, અમારા રાજકીય વિરોધીઓ કેન્દ્રમાં સત્તામાં હતા, અને સ્વાભાવિક રીતે તેઓ ઈચ્છતા હતા કે અમારી સામેના બધા આરોપો વળગી રહે. ન્યાયતંત્રે પરિસ્થિતિનું બે વાર ઝીણવટપૂર્વક વિશ્લેષણ કર્યું અને અંતે અમને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ સ્થિત પોડકાસ્ટર અને એઆઈ સંશોધક લેક્સ ફિડમેન સાથેની એક મુલાકાતમાં ગોધરા ટ્રેન ઘટનાને "અકલ્પનીય તીવ્રતા" ની દુર્ઘટના ગણાવી હતી જે "હિંસા માટે એક ઉત્તેજક બિંદુ" બની હતી. દાયકાઓ લાંબી રાજકીય કારકિર્દીના બીજા પોડકાસ્ટમાં, મોદીએ સ્પષ્ટતા કરી કે આ અત્યાર સુધીના સૌથી મોટા રમખાણો હતા તેવી ધારણા "ખરેખર ખોટી માહિતી" છે. મોદીએ રમખાણો

પહેલાની આતંકવાદી ઘટનાઓ અને ગુજરાતમાં રમખાણોનો ઇતિહાસ કેવી રીતે રહ્યો છે તે પણ સમજાવ્યું. તેમણે ઉમેર્યું "પરંતુ ૨૦૦૨ પછી, ૨૨ વર્ષમાં ગુજરાતમાં એક પણ મોટો રમખાણ થયો નથી. ગુજરાત સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહે છે."

રમખાણોને લગતા આરોપો અંગે મોદીએ કહ્યું, "તે સમયે, અમારા રાજકીય વિરોધીઓ ચક્રેન્દ્રમાં સત્તામાં હતા, અને સ્વાભાવિક રીતે તેઓ ઈચ્છતા હતા કે અમારી સામેના બધા આરોપો ટકી રહે. તેમના અવિરત પ્રયાસો છતાં, ન્યાયતંત્રે પરિસ્થિતિનું બે વાર બારીકાઈથી વિશ્લેષણ કર્યું અને અંતે અમને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા. જે લોકો ખરેખર જવાબદાર હતા તેમને અદાલતો તરફથી ન્યાયનો સામનો કરવો પડ્યો છે."

ફિડમેને તેમના પોડકાસ્ટમાં, જેમાં અંગ્રેજી (US), હિન્દી, હિન્દી લેટિન અને રશિયન ભાષામાં ઓડિયો ટ્રેક છે, મોદીને



૨૦૦૨ માં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન થયેલી ગુજરાત કોમી હિંસામાંથી શું શીખ્યા તે વિશે પૂછ્યું, જેમાં ૧,૦૦૦ લોકો માર્યા ગયા હતા, જ્યારે સુપ્રીમ કોર્ટે ૨૦૧૨ અને ૨૦૨૨ માં બે ચુકાદા આપીને તેમને કલીનચીટ આપી હતી. મોદીએ કહ્યું કે, "તમે ઉલ્લેખ કરેલી અગાઉની ઘટનાઓ, જેમ કે ૨૦૦૨ માં ગુજરાતમાં થયેલા રમખાણો,

હું તમને તે સમયના વાતાવરણને સંપૂર્ણપણે સમજી શકે તે પહેલાંના ૧૨ થી ૧૫ મહિનાનું સ્પષ્ટ ચિત્ર દોરવા માંગુ છું. ઉદાહરણ તરીકે, ૨૪ ડિસેમ્બર, ૧૯૯૯ ના રોજ લો, લગભગ ત્રણ વર્ષ પહેલાં, કાઠમંડુથી દિલ્હી જતી એક ભારતીય ફ્લાઈટનું હાઈજેક કરવામાં આવ્યું હતું, તેને અફઘાનિસ્તાન રીડાયરેક્ટ કરવામાં આવ્યું હતું અને કંદહારમાં ઉતારવામાં આવ્યું હતું. સેંકડો ભારતીય મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા. તેનાથી સમગ્ર ભારતમાં ભારે અશાંતિ ફેલાઈ ગઈ હતી કારણ કે લોકો જીવન અને મૃત્યુની અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા હતા."

પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું, "પછી, વર્ષ ૨૦૦૦ માં, દિલ્હીના લાલ કિલ્લા પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. રાષ્ટ્ર પર ફરી એક સંકટ આવ્યું, જેનાથી ભય અને અશાંતિ વધી ગઈ. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ ના રોજ, અમેરિકાના ટવીન ટાવર્સ પર એક વિનાશક આતંકવાદી હુમલો થયો, જેણે ફરી એકવાર સમગ્ર વિશ્વને આઘાત આપ્યો. કારણ કે આખરે, આ હુમલાઓ પાછળના

લોકો સમાન માનસિકતાથી પ્રેરિત છે. પછી ઓક્ટોબર ૨૦૦૧ માં, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો. તેના થોડા સમય પછી, ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ ના રોજ, ભારતની સંસદને નિશાન બનાવવામાં આવી." મોદીએ કહ્યું કે, "માત્ર આઠ થી દસ મહિનામાં, આ મોટા વૈશ્વિક આતંકવાદી હુમલાઓ થયા, હિંસક ઘટનાઓ બની જેના કારણે ખુન ખરાબો થયો અને નિર્દોષ લોકોના જીવ ગયા. આવા તણાવપૂર્ણ વાતાવરણમાં, નાની તણાવા પણ અશાંતિ ફેલાવી શકે છે. પરિસ્થિતિ પહેલાથી જ અત્યંત અસ્થિર બની ગઈ હતી. આવા સમયમાં, અચાનક, ૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના રોજ, મને ગુજરાતના મુખ્યમંત્રી બનવાની જવાબદારી સોંપવામાં આવી. આ એક મોટો પડકાર હતો." મોદીએ વધુમાં કહ્યું કે, "તે સમયે, ગુજરાત એક વિનાશક ભૂકંપમાંથી બહાર આવી રહ્યું હતું, જે પાછલી સદીનો સૌથી મોટો ભૂકંપ હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. મુખ્યમંત્રી તરીકે મારું પહેલું મોટું કાર્ય બચી ગયેલા લોકોના પુનર્વસનનું

નિરીક્ષણ કરવાનું હતું. આ એક મહત્વપૂર્ણ કાર્ય હતું, અને શપથ લીધા પછીના પહેલા દિવસથી, મેં મારી જાતને તેમાં ડૂબાડી દીધી.

હું એક એવો વ્યક્તિ હતો જેને સરકારનો કોઈ અનુભવ નહોતો. હું ક્યારેય કોઈ વહીવટનો ભાગ રહ્યો ન હતો, પહેલા ક્યારેય સરકારમાં પણ રહ્યો ન હતો. મેં ક્યારેય ચૂંટણી લડી ન હતી, ક્યારેય રાજ્યનો પ્રતિનિધિ પણ નહોતો. મારા જીવનમાં પહેલી વાર મને ચૂંટણીનો સામનો કરવો પડ્યો."

પીએમ મોદીએ કહ્યું કે, "૨૪ ફેબ્રુઆરી, ૨૦૦૨ ના રોજ હું રાજ્યનો પહેલી વાર ચૂંટાયેલો પ્રતિનિધિ બન્યો. અને ૨૪, ૨૫ કે ૨૬ ફેબ્રુઆરીની આસપાસ જ મેં પહેલી વાર ગુજરાત વિધાનસભામાં પગ મુક્યો. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ ના રોજ, અમે બજેટ સત્ર માટે વિધાનસભામાં બેઠા હતા. અને તે જ દિવસે, હું રાજ્યનો પ્રતિનિધિ બન્યો તેને માત્ર ત્રણ દિવસ થયા હતા, ત્યારે અચાનક ગોધરાકાંડની ભયાનક ઘટના બની. તે અકલ્પ નીય તીવ્રતાની દુર્ઘટના હતી, લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

ન્યૂઝ ફ્રન્ટ

શાંતિ ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે યુકેન અને રશિયા વાતચીત માટે બેસે

। નવી દિલ્હી, તા.૧૬ । વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેક્સ ફિડમેન પોડકાસ્ટમાં કહ્યું છે કે યુકેનમાં શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનમાં નહીં પરંતુ વાતચીતની ટેબલ પર છે. તેમણે બંને યુદ્ધપ્રસ્ત દેશોને ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધને સમાપ્ત કરવા માટે ચર્ચા કરવા અનુરોધ કર્યો. વડાપ્રધાને વધુમાં કહ્યું કે યુકેન તેના મિત્ર દેશો સાથે શાંતિ વિશે "અનેક ચર્ચાઓ" કરી શકે છે, પરંતુ શાંતિ ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે યુકેન અને રશિયા બંને વાતચીત માટે બેસે. પીએમ મોદીએ આ મામલે કહ્યું કે "મારા રશિયા અને યુકેન બંને સાથે નજીકના સંબંધ છે. હું રાષ્ટ્રપતિ પુતિન સાથે બેસી કહી શકું છું કે આ યુદ્ધનો સમય નથી, અને હું રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ મૈત્રીપૂર્ણ રીતે કહી શકું છું કે ભાઈ, દુનિયામાં કેટલા લોકો તમારી સાથે ઊભા છે, પરંતુ યુદ્ધના મેદાનમાં ક્યારેય ઉકેલ નહીં આવે." તેમણે કહ્યું કે અગાઉની શાંતિ ચર્ચાઓ મુશ્કેલ હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ યુદ્ધને સમાપ્ત કરવા માટે અંકબીજાની સાથે વાતચીત કરવાની તક પ્રદાન કરે છે.

ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, આતંકી અબુ કતાલની હત્યા કરાઈ

। ઈસ્લામાબાદ, તા.૧૬ । પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનું મોત થયું છે. લશ્કર એ તેયબાના આતંકી અબુ કતાલ સિંધીની હત્યા કરવામાં આવી છે. ભારતે અબુ કતાલને મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કર્યો હતો. ભારતમાં અનેક આતંકી હુમલામાં અબુ કતાલનો હાથ છે. જમ્મુ કાશ્મીરમાં અનેક હુમલા કરવાનો માસ્ટરમાઈન્ડ હતો. અબુ કતાલ આતંકી હાફિઝ સઈદનો ભત્રીજો હતો. અજાણ્યા બાઈકચાલકોએ ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. અબુ કતાલની સાથે રહેલા તેના સાગરીતનું પણ મોત નિપ જ્યું છે. ૨૦૦૮ ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો ભત્રીજો અને કુખ્યાત આતંકવાદી અબુ કતલને પાકિસ્તાનમાં ઠાર મારવામાં આવ્યો છે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું મુસ્લિમ સમાજને શિક્ષણની જરૂર, IAS-IPS બનશે તો સમાજનું ભલું થશે

નાગપુરમાં લઘુમતી સંસ્થાના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીનું જાતિ અને ધર્મ પર ટિપ્પણીથી દૂર રહેવાનું આહ્વાન

। (એજન્સી) નાગપુર, તા.૧૬ । કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. નાગપુરમાં એક લઘુમતી સંસ્થાના દીક્ષાંત સમારોહમાં હાજરી આપતી વખતે નીતિન ગડકરીએ જાતિ અને ધર્મ વિશે વાત કરનારાઓ સામે કડક વલણ દાખવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, "જે કરશે જાતિની વાત તેને મારીશ જોરથી લાત." આ કાર્યક્રમમાં ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ જાહેરમાં ધર્મ અને જાતિ વિશે કોઈ વાત કરતા નથી. તેમના માટે સૌથી ઉપર સમાજ સેવા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભલે તેઓ ચૂંટણી હારી જાય કે મંત્રીપદ ગુમાવી દે, તેઓ આ સિદ્ધાંત પર હંમેશા અડગ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમને મંત્રીપદ નહીં મળે તો તેનાથી તેમનું જીવન અટકી નહીં જાય. ગડકરીએ વધુમાં જણાવ્યું કે તેમના કેટલાક મિત્રોએ તેમને જાહેર જીવનમાં આવા નિવેદનો



ન કરવા સલાહ આપી હતી, પરંતુ તેમણે જીવનમાં આ સિદ્ધાંતનું પાલન કરવાનો નિશ્ચય કર્યો છે. પોતાના સંબોધનમાં નીતિન ગડકરીએ શિક્ષણના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણમાં જીવન બદલવાની અપાર તાકાત રહેલી છે અને તે વ્યક્તિ તેમજ સમુદાયોને સકારાત્મક દિશામાં પરિવર્તિત કરી શકે છે. નીતિન ગડકરીનું આ નિવેદન હાલમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે, જેમાં તેમના સમર્થકો તેમના સ્પષ્ટ અને નિખાલસ અભિગમની પ્રશંસા કરી રહ્યા

છે, જ્યારે વિરોધીઓ તેમના કડક શબ્દો સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. જો કે, ગડકરી પોતાના નિવેદન પર મક્કમ રહ્યા હોવાનું જણાય છે અને તેમણે સમાજ સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વાત ફરી દોહરાવી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મુસ્લિમ સમાજમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો છે. નાગપુરમાં એક દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે મુસ્લિમ સમાજે માત્ર પરંપરાગત શિક્ષણ પર જ નહીં પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીને પણ આત્મસાત કરવું જોઈએ. પોતાના સંબોધનમાં ગડકરીએ જણાવ્યું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રમાં ધારાસભ્ય હતા ત્યારે તેમને એક એન્જિનિયરિંગ કોલેજ મળી હતી, જે તેમણે નાગપુરની અંજુમન ઈસ્લામને આપી દીધી હતી. જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મુસ્લિમ સમાજમાં શિક્ષણની સૌથી વધુ જરૂરિયાત છે.

અમેરિકામાં વાવાઝોડાએ મચાવી તબાહી, ૩૨ના મોત

। (એજન્સી) વોશિંગ્ટન, તા.૧૬ । અમેરિકાના ઘણા વિસ્તારોમાં આવેલા ભીષણ વાવાઝોડામાં ઓછામાં ઓછા ૩૨ લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ માહિતીની પુષ્ટિ કરી છે. મિઝોરી હાઈવે પર પેટ્રોલીંગ કરતી ટીમે શનિવારે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે ફક્ત મિઝોરીમાં જ ૧૨ લોકો માર્યા ગયા છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, આ વાવાઝોડામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. શનિવારે સવારે અરકાનસાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે

ઈન્ડિપેન્ડન્સ કાઉન્ટીમાં ત્રણ લોકો માર્યા ગયા છે, જ્યારે આઠ અન્ય કાઉન્ટીઓમાં ૫૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. અરકાનસાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યભરના ૧૬ કાઉન્ટીઓમાં ઘરો અને વ્યવસાયોને નુકસાન થયું છે. આ સાથે, વીજ તાર અને વૃક્ષો પડવાની ઘણી ઘટનાઓ પણ નોંધાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેક્સાસ પેનહેન્ડલમાં અમરિકલો કાઉન્ટીમાં ધૂળના તોફાન દરમિયાન કાર અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે.

દિગ્ગજ બેટર વિરાટ કોહલી

બીસીસીઆઈના નિયમથી બિલકુલ ખુશ નથી

। (એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬ । ભારતીય દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ BCCના નવા નિયમ ક્રિકેટ ટૂર પર ખેલાડીઓ સાથે પરિવારના જવા પર પ્રતિબંધની ટીકા કરી છે. ૩૬ વર્ષીય ધુરંધર ખેલાડી કોહલીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓના પર્ફોર્મન્સમાં તેમનો પરિવાર મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ ટૂર પર પ્રવાસ દરમિયાન તેઓ મુશ્કેલીઓ અનુભવે છે. હાલમાં જ રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની જીતમાં ફાળો આપનારા ખેલાડીઓમાં વિરાટ કોહલી પણ સામેલ છે. તેણે કુઆંધાર બેટિંગથી ટીમ ઈન્ડિયાને જીત આપવામાં ફાળો આપ્યો છે.

ઉત્તર મેસેડોનિયામાં મોટી દુર્ઘટના

ઉત્તર મેસેડોનિયાના નાઈટક્લબમાં આગ લાગવાથી ૫૧ લોકોના મોત

રવિવારે સવારે નાઈટક્લબ પલ્સમાં એક પોપ ગ્રુપના કોન્સર્ટ દરમિયાન આગ લાગતા ભારે અફસાદફડી મચી

। (એજન્સી) કોકાની, તા. ૧૬ ।



નાઈટક્લબ પલ્સમાં એક પોપ ગ્રુપ ના કોન્સર્ટ દરમિયાન આગ લાગી હતી. ક્લબની મુલાકાતે આવેલા યુવાનો ફટાકડા ફોડી રહ્યા છે. જેના કારણે ક્લબની છતમાં આગ લાગી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ક્લબમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સંગીત જૂથની જોડી સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી.

। (એજન્સી) હુનઈ, તા. ૧૬ ।

દિબ્રુગઢની જેલમાં બંધ પંજાબમાં ખાલિસ્તાનવાદી નેતા અને સાંસદ અમૃતપાલ સિંહના સાત સાથીઓ અંગે પંજાબ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે NSA હેઠળ અમૃતપાલના ૭ સાથીઓ સામે NSAની અવધિ ન વધારવાનો નિર્ણય લેવાનો છે. આ તમામ આરોપીઓ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાના આરોપી છે. સૂરોના જણાવ્યા મુજબ, અમૃતપાલ સિંહના સાત સાથીઓ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ દિબ્રુગઢની જેલમાં બંધ છે, જેમની સામે પંજાબ સરકારે NSA ન વધારવાનો નિર્ણય લીધો છે.

સુનિતા વિલિયમ્સ જલદી ધરતી પર ફરશે પરત

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ફૂ-૧૦ અંતરિક્ષમાં પહોંચી ગયું

। (એજન્સી) વોશિંગ્ટન, તા. ૧૬ । સુનિતા વિલિયમ્સની વાપસી અંગે મોટી ખબર આવી છે. લાંબા સમયથી અંતરિક્ષમાં ફસાયેલા બંને સભ્યો જલદી પૃથ્વી પર પરત ફરશે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ફૂ-૧૦ તેમને લેવા માટે અંતરિક્ષમાં પહોંચી ગયું છે. સુનિતા અને બુચ સાથે ફૂ-૧૦ના સભ્યોની મુલાકાત થઈ છે. આ સભ્યોએ બન્નેના હાલચાલ જાણ્યા હતા. થોડા જ સમયમાં ડોર્કિંગની પ્રક્રિયા શરૂ થશે. ૧૯ માર્ચ ધરતી પર સુનિતા અને બુચ પૃથ્વી પર આવી પહોંચશે. ગાસ સુનિતા વિલિયમ્સ માટે દેશભરમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. રવિવારે સ્પેસએક્સ ફૂ ડ્રેપ્યુલ સફળતા પૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ડોક થયું છે, જેનાથી નાસાના બે ફસાયેલા ફૂ સભ્યો બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ, જેઓ નવ મહિનાથી વધુ સમયથી ભ્રમણકક્ષામાં ફસાયેલા છે, તેમના સ્થાને અવકાશયાત્રીઓની એક નવી ટીમ પહોંચી છે. યુનાઈટેડ સ્ટેટ્સ, જાપાન અને રશિયાનું પ્રતિનિધિત્વ કરતા ચાર નવા આગમન કરનારાઓ, વિલ્મોર અને વિલિયમ્સના માર્ગદર્શન હેઠળ સ્ટેશનની અંદર અને બહાર શીબવમાં આગામી થોડા દિવસો વિતાવશે. તેના બાદ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જલ્દી જ રિટર્ન થશે.

પ્રેરણા અને ધ્યાન કેન્દ્રિત કરવાનો માર્ગ

આજના વ્યસ્ત અને ઊંંચી સ્પર્ધાની દુનિયામાં દરેક વ્યક્તિને પ્રેરણા અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત



પ્રેરણા એ છે, જે આપણને દિશા અને ઉત્સાહ આપે છે, અને ધ્યાન કેન્દ્રિત કરવું એ એ છે, જે આપણને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અડચણોથી પાર પાડે છે. આ લેખમાં, અમે જીવનમાં પ્રેરણા અને ગોલ સેટિંગ માટેનું માર્ગદર્શન અને ટિપ્સ પર ચર્ચા કરીશું. જીવનમાં પ્રેરણા અને ચૈતિન્ય મેળવવા માટે નમ્ર અભિગમ: પ્રેરણા એ એ ક્ષેત્ર છે, જે દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. જ્યારે આપણે કોઈ મહત્વપૂર્ણ કામને પૂરું કરવા માટે પ્રેરિત થાવા જોઈએ, ત્યારે તે એક નમ્ર અભિગમ સાથે થાય છે. વ્યક્તિ, જો પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો એ સકારાત્મક દૈનિકોણથી આગળ વધી શકે છે. ધ્યાન અને આરામ: પ્રેરણા મેળવવા માટે સૌથી પહેલા જરૂરી છે તમારી અંદરની શાંતિ. આ માટે તમે ધ્યાન કરી શકો છો, યોગ અથવા પ્રાકૃતિક વાતાવરણમાં આરામ કરવાનો પ્રયાસ કરી શકો છો. પ્રથમ આત્મવિશ્વાસ: જો તમે તમારી જાત પર વિશ્વાસ રાખતા છો, તો બધી અવરોધોને પાર કરી શકશો. સફળતા એ તમારા મન અને આત્મવિશ્વાસમાં નમ્રતા અને આત્મસન્માન સાથે જ પ્રાપ્ત થાય છે. નમ્ર અભિગમ: પ્રેરણા મેળવવા માટે, મનુષ્ય નમ્ર અને સંતુલિત રહેવું જોઈએ. આથી, પોતાની ક્ષમતાઓ અને મર્યાદાઓને સ્વીકારવું મહત્વપૂર્ણ છે. જો તમારી પાસે નમ્રતા છે, તો તમે કોઈ પણ સમસ્યાને સરળતાથી પહોંચી શકે છે. ગોલ સેટિંગ માટે અસરકારક ટિપ્સ: હવે આપણે વાત કરીએશું કે ગોલ સેટિંગ કેવી રીતે કરવું અને તેના માટે કેટલીક અસરકારક ટિપ્સ શું હોઈ શકે છે. સચોટ ગોલ સેટિંગ એ તમારા લક્ષ્ય સુધી પહોંચવાના માર્ગને સ્પષ્ટ અને સરળ બનાવે છે. તમારા લક્ષ્યને સ્પષ્ટ રીતે નિર્ધારિત કરો. "મેં એક દિવસમાં ૧૦ કિ.મી. દોડવાનું છે" એ એક સ્પષ્ટ અને સચોટ લક્ષ્ય છે. તમારું લક્ષ્ય માપી શકાય એવું હોવું જોઈએ. આથી, તમે તમારું વિકાસ અને યાત્રાને અનુસરી શકો છો. તમારું લક્ષ્ય તમારી ક્ષમતા મુજબ હોવું જોઈએ. તે યોગ્ય રીતે પ્રાપ્ય હોવું જોઈએ, અને તમે તેને આદરપૂર્વક હાંસલ કરી શકો છો. તમારું લક્ષ્ય તમારા મુખ્ય ધ્યેય અને જીવનની શ્રેષ્ઠતા સાથે સંબંધિત હોવું જોઈએ. તે તમારી તાત્કાલિક જરૂરિયાતોને સંતોષવું જોઈએ. તમે તમારા લક્ષ્યને હાંસલ કરવાની મર્યાદિત સમયરેખા ઊભી કરો. ઉદાહરણ તરીકે, "મેં આ વર્ષના અંતે ૫ કિ.મી. દોડવાની ક્ષમતા મેળવી છું". પ્રેરણાદાયી વ્યક્તિઓ અને તેમની સાહસિક યાત્રાઓ: પ્રેરણા માટે ઘણીવાર આપણે પ્રસિદ્ધ વ્યક્તિઓ અને તેમની સફળતા પર નજર કરીએ છીએ. આમાં ઘણા એવા લોકો છે જેમણે બધી મુશ્કેલીઓને પાર કરી અને દુનિયાને બતાવ્યું કે શું શક્ય છે. માર્ટિન લુથર કિંગ જુનિયર એ સમાનતાની અને ન્યાય માટે લડનારા પ્રતિસાદી વ્યક્તિ હતા. તેમના "I Have a Dream" ભાષણમાં તેણે તમામ લોકો માટે સમાન અધિકાર માટેની લડાઈનો સંકેત આપ્યો. તેમના જીવનનો માર્ગ એ તે લોકો માટે એક પ્રેરણા છે જેમણે પોતાના ઉદ્દેશ માટે સતત પ્રયત્નો કર્યા. એલેક્સેન્ડર ગ્રામ બેલ: એલેક્સેન્ડર ગ્રામ બેલ એ ીક્કૈરની નો આવિષ્કાર કર્યો, જેના કારણે આજના સમયની વાતચીત સરળ થઈ. તેમણે ખૂબ જ કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈને એક એવી શોધ કરી, જે દુનિયાને બદલી નાખી. મિસીસ શ્રીમતી ભારતિ : મિસીસ શ્રીમતી ભારતિ એક ગ્રામીણ વિસ્તારની મહિલા છે, જેણે બાળલગ્ન અને કાયદેસરની અવગણના સામે લડાઈ લડી. આજે તે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને અને કઠિન શિલ્પો માટે એક પ્રેરણા બની છે. અલ્બર્ટ આઈન્સ્ટાઈનને સ્કૂલમાં લાંબી સમજણ સાથે ઘણીવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમણે એ નિષ્ફળતાઓને પોતાનું માર્ગદર્શન બનાવતાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેમની જીવન યાત્રા એ બતાવે છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ જો એકા હોય તો સકારાત્મક પરિણામો મળી શકે છે.

આપણે સફળ થવા માટે સકારાત્મક દ્રષ્ટિકોણ અને ઉત્સાહ જાળવવાની તકો ઓળખી શકીએ?

દરેક વ્યક્તિની જીવનયાત્રામાં એક એવો સમય આવે છે જ્યારે તેને તેનાં લક્ષ્ય અને સફળતા માટે જોરદાર ઉત્સાહની જરૂરિયાત હોય છે. જો આપણે સફળ થવા માટે સકારાત્મક દ્રષ્ટિકોણ અને ઉત્સાહ જાળવવાની તકો ઓળખી શકીએ, તો અમને ખૂબ ઓછા સમયમાં એ સફળતા મળશે જે આપણે યાદીએ છીએ. આ લેખમાં, આપણે ઉત્સાહ અને સફળતા માટેનો માર્ગ જોવશું, જે મન અને શરીર બંનેમાં આત્મવિશ્વાસ અને પ્રેરણા લાવશે. સાનુકૂળ દ્રષ્ટિકોણ અને ઉત્સાહ જાળવવો: દરેક સફળ વ્યક્તિના જીવનમાં પ્રથમ અને સૌથી અગત્યનો તત્વ તે છે જેનું મૌલિક માન્યક છે - "Positive Outlook." જ્યારે તમારા મનમાં સકારાત્મકતા છે, ત્યારે તમારા માટે કોઈ પણ મુશ્કેલી એક તકો બની જાય છે, અને સફળતા પહોંચવાનો માર્ગ સરળ બની જાય છે. વિશ્વસનીયતા (Belief in Yourself): સફળતા માટે, તમારે પહેલા તમારી જાત પર વિશ્વાસ રાખવો જરૂરી છે. આ વિશ્વસનીયતા તમને એ માર્ગ પર ખીંચશે જ્યાં તમારું સ્વપ્ન સત્ય બની શકે. જ્યારે તમે નમ્રતા અને વિશ્વસનીયતા સાથે આગળ વધો છો, ત્યારે તમે પોતાની આસપાસના લોકોને પણ પ્રેરણા આપો છો.

કોઈપણ પરિસ્થિતિમાં ઉત્સાહ જાળવો (Keep Enthusiasm in Any Situation): દરરોજ જીવનમાં તમારા ધ્યેય તરફ આગળ વધતા રહો, ભલે તે જેટલી કઠિન પરિસ્થિતિ હોય. ઉત્સાહ એ માનસિક મૂલ્ય છે જે તમને દરેક મુશ્કેલીમાં આગળ વધવામાં મદદ કરે છે. સકારાત્મક આત્મસંવાદ (Positive Self-Talk): "હું તે કરી શકું છું", "આ મારી ક્ષમતા છે" એ વાક્યો તમારા મનને સકારાત્મક બનાવે છે. વિશ્વાસ અને દૈનતા (Faith and Resilience): ઉત્સાહ માત્ર કામના સમયે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તમને પડકારોનો સામનો કરવાના સમયે પણ તેની શ્રેષ્ઠતા દેખાવા જોઈએ. તમે નિષ્ફળતા અથવા મોંઘવારીનો સામનો કરી રહ્યા હો, ત્યારે "તમારા વિશ્વાસને ન ગુમાવવું" એ મહત્વપૂર્ણ છે. નકારાત્મક વિચારોથી મુક્તિ મેળવનારી પ્રેરણા: દરેક માણસના જીવનમાં ક્યારેક નકારાત્મક વિચારો અને સંશય સર્જાય છે, પરંતુ એ



માત્ર એક અવરોધ છે. નકારાત્મકતા કોઈનો માર્ગચૂકાવતી નથી; તે તો તેના પ્રયાસોને નસીબ કે સમય સાથે કઢાય છે.

વિશ્વસનીય પ્રેરણા સ્ત્રોતો (Reliable Sources of Inspiration): તમારા નકારાત્મક વિચારોથી મુક્તિ મેળવવા માટે, સકારાત્મક લોકો સાથે સમય વિતાવવો, પ્રેરણાદાયી પુસ્તક વાંચવું, અથવા તમારી યાહના માટે આત્મવિશ્વાસને પેદા કરતી વિડિયો જોઈ શકતા હોય તો આ તમારા મનને નવજીવન આપશે. વિશ્વસનીય લોકો સાથે સંલગ્ન રહેવું (Stay Connected with Positive People): તમે જેમને સાથે રહેતા હો, એ લોકો તમારી

તાજગી જાળવવા અને સ્વસ્થ રહેવા માટે કેટલીક ઉપયોગી ટિપ્સ

જે ગરમીમાં રહેતી વ્યક્તિઓ માટે ખૂણાની ખૂણાથી મદદરૂપ થઈ શકે છે, આ ટિપ્સ સાથે, તમે ગરમીમાં સુખી, આરોગ્યદાયક અને તાજ રહી શકો છો

હીટ પોઈઝનિંગથી બચવા માટે અને સ્વસ્થ રહેવા માટે ટીપ્સ કરવું? (Avoiding Heat Strkoe and Staying Healthy): હીટ પોઈઝનિંગ એ એક ગંભીર સ્થિતિ છે જે ગરમીના અતિરેક પ્રવાહને કારણે થાય છે. જ્યારે શરીર તાપમાન નિયંત્રણમાં ખોટું થઈ જાય છે, ત્યારે તે હીટ સ્ટ્રોક અથવા હીટ એક્ઝોઝન તરફ દોરી શકે છે. આથી, નીચેના પગલાં અપનાવવાથી તમે હીટ પોઈઝનિંગથી બચી શકો છો: આફ્ટરનેન અને મધ્યાહ્ન સમયમાં બહાર ન જાવ: સૂર્યપ્રકાશમાં બીલકુલ જ જવાનું ટાળો, ખાસ કરીને ગરમીના પિક આછા સમય (બપોરના ૧૨ થી ૩ વચ્ચે). ઠંડા જગ્યાએ આરામ કરો: જો તમારે બહાર જવું પડે, તો ઠંડા અને વાતાવરણીય રીતે આરામદાયક સ્થળ પર જવાનો પ્રયાસ કરો. ઠંડા પાણી પીતા રહો: હીટ પોઈઝનિંગથી બચવા માટે શરીરમાં પાણીની ખોટ ન થવા દેવી જોઈએ. નિયમિત રીતે ઠંડું પાણી પીવું. શરીરનું તાપમાન નિયંત્રણ કરો: ગરમીમાં નમ શર્ટ્સ અને હલકાં કપડાં પહેરો. આ વસ્તુઓ શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગરમીમાં પાણીને જાળવી રાખવા માટેની રીતો (How to Stay Hydrated in the Summer): ગરમીમાં પાણીની ખોટ ખૂબ જ ઝડપી થઈ શકે છે, જેના કારણે તમારી શારીરિક ક્ષમ્તિ ઘટી શકે છે. આથી, ઠંડા પાણી સાથે વિટામિન અને મિનરલ્સ પણ તમારા શરીર માટે મહત્વપૂર્ણ છે. પ્રતિ ૩૦ મિનિટે પાણી પીવો: દિવસ દરમિયાન આરામથી, નિયમિત અંતર પર પાણી પીતા રહેવું. એક સારો હેતુ એ છે કે તમારી ખુરાકમાં પાણીનો પુરાવા ૮-૧૦ ગ્લાસ પાણી કે તે વધુ હોવો જોઈએ. પાણીમાં મીઠું અને ખાંડ ન ઉમેરો: ગરમીમાં ખાવાની વસ્તુઓમાં મીઠું અને ખાંડ વધે છે, જેના કારણે શરીરમાં



પાણીનો સ્તર વધુ ખોટો થઈ શકે છે. ફળના જ્યુસ અને દ્રાવ્ય પીણાં: પાંદળિયા અને ખાટા ફળના જ્યુસને પિતા, જેમ કે નારિયેલ પાણી અને શરબત, પાણીને યોગ્ય રીતે જાળવી રાખવામાં મદદ કરી શકે છે. ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનો ઉપયોગ કેમ કરવામાં આવવો જોઈએ? (Why Should Fruits and Vegables be Used in Summer?): ગરમીમાં ફળો અને શાકભાજીનો ઉપયોગ ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા શરીરને તાજગી અને પોષણ પ્રદાન કરે છે. ફળોમાં વધુ પાણી અને વિટામિન: અનેક ફળોમાં ખાસ કરીને પાણીની પ્રમાણવારં અને વિટામિન C, A અને B-કોમ્પ્લેક્સ હાજર છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. જેમ કે, કાકડી, તાંગો, તરબૂચ અને નાશપાતી જેવા ફળો ગરમીમાં તાજગી પ્રદાન કરે છે. શાકભાજીમાં પોષક તત્વો: લીલાં શાકભાજી, જેમ કે પાલક, મેથી, તુલસી અને કોથમીર, પોષક તત્વો સાથે ભરપૂર હોય છે. તેમાં તાજગી અને પોષણ છે, જે ઉર્જાવાન રહેવા માટે જરૂરી છે. ફળોના સળગાવવાળા પોષણ: જલથી ભરપૂર અને નૈતિક ગુણવત્તાવાળા

શરીર અને મન માટે ગરમીથી સંભાળવાની રીતો

ગરમીનો તોફાન શરૂ થઈ રહ્યો છે, અને આ સમય દરમિયાન શરીર અને મન બંનેને સંભાળવું અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. ગરમીની ઉષ્મા, તાપમાનના વધારાની અસર, અને શારીરિક-માનસિક દબાણ તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આ લેખમાં, અમે ગરમીમાં શરીર અને મન માટે યોગ્ય સંભાળ અને રાખવાવિધીઓ વિશે ચર્ચા કરીશું. ગરમીમાં આપણા મન પર શારીરિક તણાવ અને ગરમીના કારણે દુખાવાનો પ્રભાવ પડી શકે છે. આથી, ગરમીમાં મનને ઠંડું અને આરામદાયક રાખવું મહત્વપૂર્ણ છે. યોગ અને ધ્યાન એ ગરમીમાં માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ રીતો છે. ગરમીથી ઉભા થતા માનસિક તણાવ, ચિંતાઓ અને સ્ટ્રેસને ઘટાડવા માટે, રોજ સવારે ૧૫-૨૦ મિનિટ માટે ધ્યાને લાગવું તથા યોગ વ્યાયામ કરવો, તમારા મનને શાંતિ અને સકારાત્મક ઉર્જા આપે છે. શ્વાસની કસરતો, જેમ કે પ્રાણાયામ, એ પણ મનને શાંત રાખવામાં મદદ કરે છે. તમારે આસપાસનો વાતાવરણ ઠંડો અને આરામદાયક બનાવવો જોઈએ. ઠંડા પંખાં, પોષણપૂર્વક હળવા કપડા પહેરવાં, ઠંડા ઠંડા પાણીથી બાથ લાવવાનો અને પાક જેવી હરિયાળી જગ્યામાં સમય ગુજારવાનો, આ તમારી માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક

રહેશે. ગરમીની દુખદાયક સ્થિતિઓમાંથી બહાર નીકળી, સકારાત્મક વિચારધારાને અપનાવવી જરૂરી છે. જીવનમાં નવી આશાઓ અને સ્વપ્નો માટે કામ કરવું, અથવા કોઈ એવું શોખ અપનાવવો જે આનંદ આપે, એ મનની શુદ્ધતા અને આરામ માટે મહત્વપૂર્ણ છે. મિત્રો, પરિવાર અને સજાગ વ્યક્તિઓ સાથે વાત કરવાથી, આપણે પોતાના મનના તાણને બહાર પાડવા અને કેટલીકવાર પોતાના દુખોને હળવા કરવા માટે મદદ લઈ શકીએ છીએ. સંબંધો જાળવવા અને મનની શાંતિ માટે સંલગ્ન રહેવું જરૂરી છે. ગરમીમાં શરીરને ક્યાં કેવા પ્રતિકૂળ પરિસ્થિતિઓથી બચાવવી હાઈડ્રેશન ગરમીમાં શરીરમાંથી પાણી વધુ બહાર નીકળી જાય છે, જેના પરિણામે પોષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. સનસ્કીન ગરમીમાં ધૂપના સીધા પ્રભાવથી તમારી ત્વચા અસરગ્રસ્ત થઈ શકે છે, ખાસ કરીને મેલાનિનના સ્તરે. પોષક તત્વોથી ભરપૂર અને SPF સાથે સનસ્કીન લગાવવું ત્વચાની જાળવણી માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ૩૦ SPF અથવા વધુ સાથે સનસ્કીનનો ઉપયોગ અને તેને દરેક ૩-૪ કલાકમાં ફરીથી લગાવવું.



આ ઋતુમાં શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે

તણાવથી દૂર રહો: ગરમીના કારણે તણાવ વધી શકે છે. યોગા, ધ્યાન અથવા મનપસંદ પ્રવૃત્તિઓ કરીને તણાવ ઓછો કરો. પૂરતી ઊંઘ લો: ગરમીમાં ઊંઘ ખલેલ પહોંચી શકે છે. નિયમિત સમયે સૂઈ જાઓ અને પૂરતી ઊંઘ લો. સમાજ સાથે જોડાયેલા રહો: મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરો. એકલતાથી બચો. સકારાત્મક રહો: નકારાત્મક વિચારોથી દૂર રહો. સકારાત્મક વિચારો મનને શાંત રાખે છે. શરીરને ઠંડું રાખો: જ્યારે શરીર ઠંડું રહેશે ત્યારે મન પણ શાંત રહેશે. પ્રવાહી ખોરાક લો: ગરમીમાં પ્રવાહી ખોરાક લેવાથી શરીર અને મન બંનેને શાંતિ મળે છે. ગરમીમાં શરીરને કઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓથી બચાવવું: હીટસ્ટ્રોકથી બચો, બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો.

દરેક વ્યક્તિ પાસે કેટલાક સ્પ્નો હોય છે - કંઈપણ મોટું અને ઉત્તમ મેળવવા માટેની તક

સ્વપ્નોને હકિકત બનાવવાનું શરૂ કરવું એ એ રીતે ટકરાવવું છે કે જેના માટે આવ્યંતર અને આયોજિત દૈનિકોણની જરૂર છે. જો તમારું સ્વપ્ન હકિકતમાં પરિવર્તિત કરવું છે, તો ચોક્કસાઈ અને શિસ્ત મહત્વપૂર્ણ છે. ખૂબ સ્પષ્ટ ગોલ સેટિંગ: જે સ્વપ્નો તમને હકિકતમાં બદલવા છે, તે માટે તમારે ચોક્કસ અને મક્કસદવાળી ગોલ સેટિંગ જરૂર છે. ગોલોને સ્પષ્ટ રીતે ગણવું, જેમ કે “હું એક વર્ષમાં ૫૦,૦૦૦ રૂપિયાનું સેવિંગ કરવાનું છું” અથવા “હું ૬ મહિના સુધી એક નવો વ્યવસાય શરૂ કરું છું” - આ ગોલ તમને માર્ગદર્શન આપે છે. લક્ષ્ય પર દૈનતા: જો તમને તમારા સ્વપ્નો સુધી પહોંચવું છે, તો તમારે દીલથી લક્ષ્ય પર નજર રાખવી પડશે. દરેક દિવસમાં, તમારે તેના માટે કોશિશો કરવી પડશે, થોડી જ કલાકોની સખત મહેનત હોય. વિશ્વસનીયતા અને શિસ્ત: તમારે તમે જે ગોલ્સ સેટ કર્યા છે, તે માટેની કાર્યની પ્રક્રિયા પર ધ્યાન આપવા માટે વિશ્વસનીયતા

અને શિસ્તની જરૂર છે. જ્યારે તમારે વિચારો, આયોજન અને દિવસની પ્રવૃત્તિઓ શિસ્તથી અનુસરીએ છે, ત્યારે જ પરિણામ પ્રાપ્ય બને છે. જ્યાં સુધી તમારે તમારા સ્વપ્નોને હકિકત બનાવવાની યાત્રા પર આગળ વધવું છે, ત્યાં સુધી તમારે શરૂ કરવાની શરૂઆત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે શરૂઆત થાય છે, ત્યારે તમારે આગળ વધતા રહેવું જોઈએ. ઘણા વખત અડચણો આવી શકે છે: સત્ય એ છે કે દરેક યાત્રામાં મુશ્કેલીઓ આવશે. ક્યારેક આપણી મહેનત વિશેષિત થતી જણાય, અથવા નસીબ પણ એમ કહી શકે છે કે તમે જે ઈચ્છો તે તમારે નહીં મળે. પરંતુ, દરેક દ્રષ્ટિએ, તમારી યાત્રાને આગળ જવામાં દૈન રહો. બધું એક ટુકડો ટુકડો છે: તમારે એક દ્રષ્ટિમાં દરેક શ્રેષ્ઠ પ્રયાસના દરેક પગલાની સખત મહેનત અને પંગત બનાવવું પડશે. તમે જ્યાં છો તે ત્યાંથી શરૂઆત કરો અને કદમમાંથી પગલાં આપતા રહો. સ્વપ્નોને કાર્યમાં ફેરવો: એક મોટું સ્વપ્ન તમારા માટે એક પ્રેરણાદાયી મૂલ્ય હોય છે.

દીપિકા પદુકોણ હાલમાં મધરહૂડ એન્જોય કરી રહી છે બોલીવૂડની મસ્તાનીએ પેરિસમાં પણ પોતાના લૂકથી લોકોને ક્યા ઘાયલ

બોલીવૂડની આઈકન અને ગ્લોબલ સેન્સેશન દીપિકા પદુકોણ હાલમાં મધરહૂડ એન્જોય કરી રહી છે. દીપિકા ભલે ફિલ્મોથી દૂર છે પણ તે અવારનવાર અલગ અલગ ઈવેન્ટ્સમાં હાજરી આપતી જોવા મળે છે.હાલમાં જ દીપિકાએ પેરિસમાં યોજાઈ રહેલાં પેરિસ ફેશન વીકમાં લૂઈ વિટોનના શોમાં હાજરી આપી હતી અને ત્યાંથી તેના બ્યુટીફૂલ અને ગ્રેસફૂલ લૂકના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ દીપિકાના આ ફોટો જોઈને એકદમ કેઝી થઈ ગયા હતા. તમારી જાણકારી માટે દીપિકા પદુકોણ એ લૂઈ વિટોનની ગ્લોબલ બ્રાન્ડ એન્બેસેડર છે અને તેણે આ લક્ઝરી બ્રાન્ડના એક્સક્લ્યુઝિવ આઉટફિટમાં હાજર પ્રેક્ષકો અને ફેન્સ પર પોતાનો જાદુ ચલાવ્યો હતો. બોલીવૂડની આઈકન અને ગ્લોબલ સેન્સેશન દીપિકા પદુકોણ હાલમાં મધરહૂડ એન્જોય કરી રહી છે. દીપિકા ભલે ફિલ્મોથી દૂર છે પણ તે અવારનવાર અલગ અલગ ઈવેન્ટ્સમાં હાજરી આપતી જોવા મળે છે.હાલમાં જ દીપિકાએ પેરિસમાં યોજાઈ રહેલાં પેરિસ ફેશન વીકમાં લૂઈ વિટોનના શોમાં હાજરી આપી હતી અને ત્યાંથી તેના બ્યુટીફૂલ અને ગ્રેસફૂલ લૂકના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ દીપિકાના આ ફોટો



જોઈને એકદમ કેઝી થઈ ગયા હતા. દીપિકા સ્ટનિંગ, ગ્રેસફૂલ લૂક જોઈને ફેન્સના દિલોની ધડકન એકદમ તેજ થઈ ગઈ હતી.વાત કરીએ દીપિકા પદુકોણના લૂકની તો આ ખાસ ઈવેન્ટ માટે દીપિકા પદુકોણે એક બ્લેક એન્ડ સિલ્વર કલરનો સ્ટનિંગ આઉટફિટ પસંદ કર્યો હતો અને કહેવાની જરૂર નથી કે દીપિકા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઈવેન્ટના કેટલાક ફોટો શેર કર્યા હતા અને તે જોત જોતામાં વાઈરલ થઈ ગયા હતા.દીપિકાના આઉટફિટની સાથે સાથે જ તેના મેકઅપ, હેરસ્ટાઈલ અને ઓવરઓલ પ્રેઝેન્સે લોકોનું ધ્યાન પોતાના પરથી હટવા જ નહોતું દીધું. દીપિકા માતા બન્યાના ગણતરીના મહિનાઓ બાદ જ જે કોન્ફિડન્સથી રેમ્પ પર વોક કર્યું હતું એ કરવા માટે ખૂબ જ હિંમતની જરૂર પડે છે. દીપિકાનું આ રેમ્પ વોક જોઈને એક વાત તો સમજાઈ જ ગઈ હતી કે દીપિકા એક સારી એક્ટ્રેસ જ નહીં પણ એક ટ્રેન્ડ સેટર પણ છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં દીપિકાના આ ફોટો જોઈને ફેન્સ દીપિકાના આ લૂકના ભરપેટ વખાણ કરી રહ્યા છે. પેરિસ ફેશન વીકમાં પહોંચેલી દીપિકાના ફોટો એટલા વાઈરલ થવા લાગ્યા.

ઐશ્વર્યા રાયને હેમા માલિની-જયા બચ્ચન બનવાની નેમ

ખો કાલે મારા પરિવારના સભ્યો મારા કામને સ્કીન પર ખેઈને શરમ અનુભવે છે

ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના અંગત જીવનને કારણે સમાચારમાં રહે છે. તેણીએ કહ્યું કે તે પોતાની છબી બદલવા માટે કપડાં નહીં બદલે. ઐશ્વર્યાએ કહ્યું કે તે જયા બચ્ચનની જેમ પુત્રવધૂ અને માતા બનવા માંગે છે અને પારિવારિક જીવનનું મહત્વ સમજાવ્યું. અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન ભલે પડાથી દૂર હોય, પરંતુ પોતાના અંગત જીવનને કારણે સમાચારમાં રહે છે. તેણીએ ૨૦૦૭ માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા. અને તે ૨૦૧૧ માં માતા બની. દીકરી આરાધ્યાને જન્મ આપ્યો. ગઈકાલે, તે અને અભિષેક આશુતોષ ગોવારિકરના પુત્ર કોણાર્કના

લગ્નમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન, તેમનું એક જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે જયા બચ્ચન જેવા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ઐશ્વર્યા રાયે ખૂબ જ પસંદગીપૂર્વક કામ કર્યું છે અને ઘણી સુપરહિટ ફિલ્મોને નકારી કાઢી છે. તેણીએ તેના કપડાંને કારણે કેટલાક દ્રશ્યો કરવાનો પણ ઈનકાર કર્યો છે. ઐશ્વર્યાએ એકવાર કહ્યું હતું કે, ‘હું મારા કપડાંથી મારી છબી બદલીશ નહીં.’ ભલે મને કોઈ કામ ન મળે, તો પણ હું ખુશ રહીશ. કેટલીક બાબતો તમે જેને પ્રેમ કરો છો, જે પરિવારમાં તમે પુત્રવધૂ અને માતા તરીકે જાઓ છો તેના માટે ખાનગી હોવી જોઈએ, તેમાં થોડી ગરિમા હોવી જોઈએ.



વીડિયો થયો વાયરલ બ્લેક બ્રાલેટ વર્કઆઉટ માટે નીકળેલી મલાઈકાએ ચાહકોના દિલ જીત્યા



બોલીવુડની ‘આઈટમ ગર્લ’ મલાઈકા અરોરા પોતાની ફિટનેસ માટે જાણીતી છે. અવારનવાર તેના જીમલુકના ફોટા વાયરલ થતા રહે છે. આ જ કારણ છે કે એકાવન વર્ષની ઉંમરમાં પણ તે પોતાના પરફેક્ટ ફિગરથી પોતાના ચાહકોને પ્રભાવિત કરે છે. મલાઈકા અરોરા હાલમાં જ મુંબઈના બાંદ્રામાં તેના વર્કઆઉટ સેશન માટે સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન તે બ્લેક આઉટફિટમાં સુંદર લાગી રહી હતી. મલાઈકાએ બ્લેક બ્રાલેટ સાથે મેચિંગ ટાઈ પહેરી હતી જેમાં તે સ્ટનિંગ લાગી રહી હતી. મલાઈકાએ બ્લેક સનગ્લાસ અને પોની ટેલ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો. તેણે પગમાં ગુલાબી સ્લીપર પહેર્યા હતા. તેના પરથી નજર હટાવવી મુશ્કેલ હતી. આ દરમિયાન મલાઈકાએ ઉભા રહીને પાપારાઝીને હેલો કહ્યું અને કેમેરા સામે પોઝ પણ આપ્યા. મલાઈકાનો આ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે ટિપ્પણી કરી- ‘ફિટનેસ દિવા.’ બીજાએ લખ્યું હતું કે સુંદર. આ સિવાય ફેન્સ તેના લુક માટે રેડ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.અહીં એ જણાવવાનું કે મલાઈકાએ ફિલ્મો સિવાય ખાસ કરીને સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ જોવા મળે છે, જ્યારે તેના કિલર લૂકને લઈને પણ વિશેષ ચર્ચા રહે છે. ઈન્સ્ટાગ્રામ પર મલાઈકા અરોરાને ૧૮ મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે, જ્યારે ચાર હજારથી વધુ પોસ્ટ કરી છે. મલાઈકાની ફેશન સાથે અજુન કપૂરના બ્રેકઅપને લઈ વધારે લાઈમલાઈટમાં રહે છે.

માતાનાં પગલે ખુશી ‘મોમ’ની સિક્વલમાં કામ કરશે બોની કપૂર દિકરી ખુશી કપૂર સાથે શ્રીદેવીની ફિલ્મની સિક્વલ બનાવશે

શ્રીદેવીની અંતિમ ફિલ્મ ‘મોમ’ની સિક્વલ બનાવવાની જાહેરાત બોની કપૂરે કરી છે. રવિવારે આઈફા એવોર્ડનું સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન થયું. આ દરમિયાન ‘મોમ’ની સિક્વલની પોતાની ઈચ્છા જાહેર કરી છે. તેઓ આ ફિલ્મ દિકરી ખુસી કપૂરને લઈને બનાવશે. આ અંગે મીડિયા સાથે વાત કરતા બોની કપૂરે કહ્યું, “મેં ખુશીની બધી જ ફિલ્મ જોઈ છે, ‘ધ આર્થિંગ’, ‘નાદાનિયા’ અને ‘લવયાપા’. હું ‘નો એન્ટ્રી’નું કામ પૂરું કર્યા પછી ખુશી સાથે એક ફિલ્મ કરવા વિચારું છું. આ ફિલ્મ ખુશી સાથે હશે, એ ‘મોમ ૨’ પણ હોઈ શકે છે. તે તેની માના પગલે ચાલવાની



સંસેસ રાજામોલી સાથે મહેશ બાબુ ઓરિસ્સાના કોરાપુતમાં શૂટિંગ કરી રહ્યા છે. હાલ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, હાલ આ ફિલ્મને એસએસએમબીર૯ નામ આપવામાં આવ્યું છે. પરંતુ આ ફિલ્મ એક જંગલ એડવેન્ચર ફિલ્મ છે તે પ્રકારની ચર્ચાઓ લાંબા સમયથી ચાલે છે. પરંતુ કોઈ કાલાકારો, રાજામોલી કે દીપ કોઈ તરફથી આ ફિલ્મ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. છેલ્લાં થોડાં દિવસ પહેલાં આ ફિલ્મના ઓરિસ્સાના સેટ પરથી કેટલાક વીડિયો વાયરલ થયા હતા. તેથી નારાજ એસએસ રાજામોલીએ હવે સેટ પર સુરક્ષાના ધારા ધોરણો કડક કરી દીધાં છે. સહુથી પહેલાં

કપૂરે આ રીતે બંને દિકરીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને બંનેની મહેનતને પણ વખાણી હતી. શ્રીદેવીની ‘મોમ’ ૨૦૧૭માં આવી હતી. રવિ ઉદયવર દ્વારા ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં શ્રીદેવીએ મજબુત માતાનો રોલ કર્યો હતો. જેમાં એક માતા પોતાની દિકરી સાથે થયેસા અન્યાયનો બદલો લે છે. આ ફિલ્મમાં શ્રીદેવીના અભિનયના ઘણા વખાણ થયા હતા અને તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. અંતિમ ફિલ્મ હોવાને કારણે આ ફિલ્મ શ્રીદેવી માટે શ્રદ્ધાંજલિ પ્રકારની ફિલ્મ બની ગઈ છે. જ્યારે ખુશી કપૂરની ‘નાદાનિયા’ તાજેતરમાં ઓટીટી પર રિલીઝ થઈ છે. જે ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ખુશી કપૂર અને ઈબ્રાહીમ ખાન સિવાય સુનીલ શેઠી, મહિમા યોધરી, દિયા મિર્ઝા અને જુગલ હંસરાજ પણ મહત્વના રોલમાં છે.

વીડિયો લીક થતા સેટની સુરક્ષા ત્રણ ગણી કરી

મહેશબાબુ અને પૃથ્વીરાજ સુકુમારને એક સાથે હેદ્રાબાદ એરપોર્ટ પરથી શૂટ કરી લેવાયા હતા. તેનો વીડિયો વાયરલ થયો હતો, આ પહેલાં કોઈ જાણતું નથી કે આ ફિલ્મમાં પૃથ્વીરાજ પણ છે. જોકે, બાદમાં તેમના માતા દ્વારા આ વાત જાહેર કરી દેવાઈ હતી. ત્યાર બાદ કોરાપુતના સેમિલિગુડામાં આવેલી સલામાલી ટેકરીઓ પરથી એક વિશાળ સેટ બની રહ્યો હોવાના વીડિયો વાયરલ થયા હતા. બે વીડિયોમાં શૂટ માટે તૈયાર થતો સેટ દેખાતો હતો. બીજા એક વીડિયોમાં મહેશ બાબુનું શૂટ દેખાતું હતું. તેનાથી ફિલ્મની દીમની ચિંતા વધી ગઈ હતી. જોકે, આ વીડિયોથી ઘણા રહસ્યો ખુલી ગયા છે.



‘છાવા’ ફિલ્મ ૭૦૦ કરોડને પાર થઈ : ‘ગદર ૨’નો રેકોર્ડ તોડ્યો

રૂપિયા ૫૩૧ કરોડના કલેક્શન સાથે આ રેકોર્ડ તૂટ્યો, હોળીનું વીકેન્ડ દમદાર રહી શકે

વિક્રી કૌશલની ‘છાવા’એ વર્લ્ડવાઈડ રૂ.૭૦૦ કરોડના કલેક્શનનો આંક વટાવી દીધો છે. મહિના બાદ પણ સફળતાપૂર્વક ચાલી રહેલી આ ફિલ્મ ૨૦૨૫ના વર્ષની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. ‘ગદર ૨’ને ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર રૂ.૫૨૫ કરોડનું કલેક્શન મળ્યું હતું. ‘છાવા’એ ‘ગદર ૨’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. હોળી પર આવી રહેલા લોંગ વીકેન્ડમાં આ ફિલ્મ ફરી પોતાની તેજ પકડે તેવી શક્યતા છે. આ અઠવાડિયું પણ ‘છાવા’ને ફળે તો રણબીર કપૂરની ‘એનિમલ’નો રેકોર્ડ તૂટી શકે છે. ‘એનિમલ’ને ડોમેસ્ટિક માર્કેટમાં ૬૬૨ કરોડનું કલેક્શન મળ્યું હતું. ‘છાવા’એ ત્રીજા અઠવાડિયાના અંતે ડોમેસ્ટિક બોક્સઓફિસમાં ૮૪.૦૫ કરોડની કમાણી કરી હતી. ત્યાર પછીનું વીકેન્ડ ઘણું સફળ રહ્યું હતું અને કમાણીમાં ૯૧ ટકા વધારા સાથે રવિવારે ૧૦.૭૫ કરોડની આવક થઈ હતી. ત્યાર પછી ચાલુ દિવસોમાં ફરી ૪૪ ટકા ઘટાડો થયો હતો અને સોમવારે માત્ર ૬ કરોડની આવક થઈ હતી. મંગળવારે પણ આ ઘટાડો યથાવત રહ્યો અને ફિલ્મે માત્ર ૫.૧૫ કરોડની જ કમાણી કરી. આ બધાં આંકડાઓ સાથે ‘છાવા’એ કુલ ૫૩૦.૯૫ કરોડની કમાણી કરી છે. મંગળવારે ફિલ્મે સમગ્ર હિન્દી ફિલ્મના સ્ક્રિનમાં ૧૦.૮૪ ટકા હાજરી નોંધાવી હતી, જ્યારે તેલુગુ ભાષાની ફિલ્મ સામે ૧૫.૧૨ ટકા હાજરી નોંધાવી હતી.જો આ સોમવાર

અને મંગળવારની આવકની વાત કરીએ તો કેટલાંક અહેવાલો મુજબ ‘છાવા’એ સોમવાર સુધીમાં વર્લ્ડ વાઈડ ૭૦૦ કરોડનો આંક પાર કરી લીધો છે. તેમજ મંગળવારે તે ૭૧૨.૫ કરોડે પહોંચી ગયું છે. અત્યાર સુધી આ મહિના દરમિયાન ઘણી ફિલ્મ રિલીઝ થઈ પરંતુ કોઈ ‘છાવા’ સામેની ટક્કરમાં સફળ રહ્યું નથી. આગળ પણ કોઈ ફિલ્મ એવી નથી દેખાતી, જે વિક્રી કૌશલ સામે મોટું જોખમ બની શકે. હવે ૧૪ માર્ચ જોલ્લ અબ્રાહમની ‘ડિપ્લોમેટ’ રિલીઝ થઈ રહી છે. પરંતુ આ ફિલ્મનો એવો કોઈ માહોલ કે ચર્ચા નથી કે તે છાવાને હંફાવી શકે. વિક્રી કૌશલે મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેણે છત્રપતિ સંભાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી. ફિલ્મનાં જ એક સીનની તસવીર મુકીને તેણે લખ્યું, “૧૧ માર્ચ ૧૬૮૯—શંભુ રાજેનો બલિદાન દિવસ. આજે, છત્રપતિ સંભાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે, હું એ યોદ્ધાને નમન કરું છું, જેમણે તાબે થવા કરતાં શહીદી પસંદ કરી, જે અકલ્પ્ય વેદનાઓ અને પીડાઓ સામે ખડા રહ્યા અને પોતાની માન્યતાઓ માટે જીવ્યા અને મર્યા. કેટલાંક પાત્ર હંમેશા તમારી સાથે રહી જતાં હોય છે. છાવામાં છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવવું એ એવાં પાત્રોમાંનું એક હતું. તેમની કથા માત્ર ઈતિહાસ નથી - એ બહાદુરી, બલિદાન અને ક્યારેય નાશ ન પામે તેવો જુસ્સો છે.



હું રેખાથી કમ નથી: મૌસમી લઈ લેતી ડાયરેક્ટરનો ઉધડો ફિલ્મમાં રેખાની ઉપર પોતાનું નામ આપવામાં આવ્યું હોવાથી મૌસમી પણ નારાજ થઈ ગયા હતા

અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા સાથે કામ કરનારી તે ખૂબસૂરત હસીના. જેમની એક અદા પર આજે પણ કરોડો લોકો મરે છે. તેણે પોતાની એક્ટિંગ કારકિર્દીમાં ૧૮૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેની પહેલી જ ફિલ્મમાં તેને તેના લીડ હીરોએ રિજેક્ટ કરી નાખી. પરંતુ પાછળથી આ એક્ટ્રેસ હિટ થવાની ગેરંટી બની ગઈ.હિન્દી સિનેમાની તે ટેલેન્ટેડ એક્ટ્રેસ જેણે પોતાની કારકિર્દીમાં દરેક પ્રકારના રોલ અદા કર્યા. તેણે પોતાના કામથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું એટલું જ નહીં, પરંતુ તેનું નામ ઘણા સુપરસ્ટાર સાથે પણ જોડાયું. અનેક હિટ અને સુપરહિટ ફિલ્મો આપનારી આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ સદાબહાર રેખા છે.પરંતુ રેખા થી અંજાઈ જવાને બદલે મૌસમી એક અલગ વ્યક્તિત્વ હતા અને તેમને દલીલ કરી હતી કે પોતે કઈ રેખાથી કમ નથી.આ એક્ટ્રેસ તેમના સમયમાં સુપરસ્ટાર તરીકે જાણીતા હતા. તેમની કારકિર્દીમાં તેમણે ઘણી હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી છે જે અમર બની ગઈ છે. એક સમય હતો જ્યારે કલાકારો તેમની સાથે કામ કરવાનું સ્વપ્ન જોતા હતા.રેખાએ ‘સાવન ભાદો’ થી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ૧૯૭૦માં રિલીઝ થઈ હતી, શશિ કપૂર પણ આ ફિલ્મના પ્રીમિયરમાં હાજર રહ્યા હતા. આ સમય દરમિયાન, દરેક વ્યક્તિ ઈન્ડસ્ટ્રીની નવી એક્ટ્રેસને જોવા માંગતો હતો. આ ફિલ્મમાં રેખા સાથે નવીન નિશ્ચલ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં રેખાને

જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ.એક એક્ટ્રેસે પોતાની કારકિર્દીની શરૂઆતમાં તે સદાબહાર એક્ટ્રેસ રેખા સાથે કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ તે સમયની વાત છે જ્યારે તેઓએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કારકિર્દીની શરૂઆતમાં તેમને ઘણી વાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો.કઠિન સંઘર્ષ પછી રેખાએ પોતાની મહેનતથી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું અને પોતાના શ્યામ રંગથી ઈન્ડસ્ટ્રીને બતાવ્યું કે તેનામાં ટોચની એક્ટ્રેસ બનવાની ક્ષમતા છે. તેમણે ૧૬ વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.આ ફિલ્મમાં રેખા સાથે નવીન નિશ્ચલ હીરો તરીકે જોવા મળ્યા હતા. જોકે આ બંનેની રેબ્યુ ફિલ્મ હતી, પરંતુ રેખાને જોતાંની સાથે જ તેણે તેની સાથે કામ કરવાનો ઈનકાર કરી દીધો. આનું કારણ રેખાનો દેખાવ હતો. આ ફિલ્મમાં રેખા સાથે મૌસમી ચેટર્જી પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. જ્યારે તેમણે જોયું કે ફિલ્મમાં મૌસમી ચેટર્જી કરતાં રેખાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે તેમણે તેમની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.ફિલ્મમાં રેખાની ઉપર પોતાનું નામ આપવામાં આવ્યું હોવાથી મૌસમી પણ નારાજ હતા. આ પછી તેમણે મેકરૂનું કહ્યું કે રેખા પહેલા તેમનું નામ આપવું જોઈએ. અને આ કારણે તેઓ નારાજ થઈ ગયા. તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે હું રેખા કરતા ઓછી નથી



‘અવતાર ૪’ અને ૫ પણ આવશે જેમ્સ કેમેરોનની ફિલ્મ અવતાર મેં જ નકારી હતી: અભિનેતા ગોવિંદા



ગોવિંદાને પાત્ર પસંદ ન હોવાથી અને લાંબા સમય સુધી શૂટિંગ કરવા માંગતા ન હોવાથી તેણે ફિલ્મ છોડી દીધી ગોવિંદા કહે છે કે જેમ્સ કેમેરોને તેમને ‘અવતાર’ ઓફર કરી હતી અને ફિલ્મનું શીર્ષક પણ તેમના સૂચન પર નક્કી કરવામાં આવ્યું હતું. ગોવિંદાને આ પાત્ર પસંદ ન હોવાથી અને લાંબા સમય સુધી શૂટિંગ કરવા માંગતા ન હોવાથી તેણે ફિલ્મ છોડી દીધી.ગોવિંદાનો દાવો છે કે જેમ્સ કેમેરોને પહેલા ગોવિંદાને ફિલ્મ ‘અવતાર’ ઓફર કરી હતી. એકેડેમી એવોર્ડ વિજેતા દિગ્દર્શકને ગોવિંદા પાસેથી ફિલ્મનું નામ ‘અવતાર’ રાખવાનું સૂચન પણ મળ્યું. મુકેશ ખત્રા સાથેની તેમની યુટ્યુબ ચેનલ પરની એક નવી મુલાકાતમાં, ગોવિંદાએ ખુલાસો કર્યો કે તેમણે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો ઈનકાર કર્યો હતો કારણ કે તેમનું પાત્ર ‘નકામું’ લાગતું હતું.વાતચીત દરમિયાન ગોવિંદાએ લોકો પર સારી ઘણી ઘટનાઓ બની છે જ્યારે તેમના શબ્દોનો કહ્યું કે એવો પ્રભાવ પડ્યો હોય. એક ઘટના યાદ કરતાં તેમણે કહ્યું, “મેં ૨૧.૫ કરોડ રૂપિયાની ઓફર પણ હુકરાવી દીધી હતી, જોકે મને તે યાદ છે કારણ કે તે પીડાદાયક હતું. હું અમેરિકામાં એક સરદારજીને મળ્યો અને તેમને મીઠાઈ અને સ્વાદિષ્ટ વાનગીઓના ક્ષેત્રમાં કામ કરવાનો વ્યવસાયિક વિચાર આપ્યો. થોડા વર્ષો પછી તેણે કહ્યું કે આ વિચાર તેના માટે અજાયબીઓનું કામ કરે છે. ત્યાં તેમણે મને જેમ્સ કેમેરોન સાથે પરિચય કરાવ્યો. તેમણે મને જેમ્સ સાથે ફિલ્મ બનાવવા કહ્યું, તેથી મેં તેને ચર્ચા કરવા માટે રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું. પહેલી ‘અવતાર’ ફિલ્મ ૨૦૦૯ માં રિલીઝ થઈ હતી, જેમાં સેમ વર્થિંગ્ટન અને ઝો સલ્ડાના મુખ્ય ભૂમિકામાં હતા.

વડોદરાની શાળાની પર્યાવરણ પ્રત્યે અદ્ભુત પહેલ! ઇન્દિરાનગર કોચાલી પ્રાથમિક શાળાએ ટકાઉ જીવનશૈલી તરફના તેમના પ્રયાસો બદલ રાજ્ય કક્ષાની માન્યતા પ્રાપ્ત કરી!



। (માહિતી) વડોદરા, તા.૧૬ ।

વડોદરા તાલુકાની ઈન્દિરાનગર કોચલી પ્રાથમિક શાળાએ પર્યાવરણ માટે કરેલા નોંધપાત્ર પ્રયાસો બદલ રાજ્ય કક્ષાની માન્યતા પ્રાપ્ત કરી છે. આ શાળાએ “જનરેશન ફોર ક્લાઈમેટ એક્શન (GenCAN)” કાર્યક્રમમાં ભાગ લીધો અને શાળા તેમજ ઘરે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના તેમના પ્રયાસો માટે પ્રમાણપત્ર અને પ્રશંસાનો માન પ્રાપ્ત કર્યો. ૧૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ ગાંધીનગરમાં સમગ્ર શિક્ષા રાજ્ય પ્રોજેક્ટ કાર્યાલય ખાતે શાળાને આ એવોર્ડ આપવામાં આવ્યો. શાળાના આચાર્ય રાકેશ પટેલ અને માર્ગદર્શક શિક્ષિકા અરુણાબેન પટેલને રાજ્યના સચિવ શ્રીમતી શિલ્પા પટેલ દ્વારા પ્રમાણપત્ર અપાયું.

આ શાળાએ HCL ફાઉન્ડેશન અને CEE દ્વારા સંચાલિત GenCAN કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને એક સચોટ એક્શન પ્લાન વિકસાવ્યો. જેના અંતર્ગત, શાળામાં અને ઘરમાં વીજળી અને પાણી બચાવવા, પ્રાકૃતિક ખાતર અને પદાર્થોનો ઉપયોગ વધારવા તેમજ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. વિદ્યાર્થીઓએ અવશ્યક હોય ત્યારે જ વીજળીનો ઉપયોગ કરવાની ટેવ વિકસાવી, ઓછા ઉર્જા વપરાશવાળા ઉપકરણો અપનાવ્યાં, પાણી બચાવવા નળ લીકેજ દૂર કર્યાં, અને ઘન કચરાને પાઉંડિયા ખાતરમાં ફેરવ્યું. આ ઉપરાંત, તેઓએ વૃક્ષારોપણ અને કુદરતી ખેતીને પણ પ્રોત્સાહન આપ્યું.

આ શાળા માત્ર શિક્ષણ પૂરતું જ સીમિત ન

પોલિસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી કાયદો વ્યવસ્થા જાળવી ઝાલોદ સંજીવની હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં સ્વજનોના આર્કંદ થી હોસ્પીટલ હીભકે ચટ્યુ

। (પ્રતિનિધી) ઝાલોદ, તા.૧૬ ।

ઝાલોદ સંજીવની હોસ્પિટલ ખાતે અંદાજીત સાંજે પાંચ વાગે દાખલ દર્દીનું મોત થતાં મૃતકના સ્વજનોના કલ્યાંત થી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતક રાકેશભાઈ નાનજીભાઈ ડામોર (કુલપૂરા) તારીખ ૧૨-૦૩-૨૦૨૫ ના રોજ સંજીવની હોસ્પિટલમા કિડની તથા લીવરની સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા. તારીખ ૧૪-૦૩-૨૦૨૫ ના રોજ સાંજે પાંચ વાગે દાખલ દર્દીનું મોત નીપજ્યું હતું. આ અંગે હોસ્પીટલના ડોક્ટર દ્વારા મૃતકના પરિવારજનો ને જાણ કરવામાં આવી હતી.

મૃતકના પરિવારજનો પોતાના પરિવારના સભ્યનું મોત થતાં ગમગીન થઈ ગયેલ હતા અને મૃતક વ્યક્તિના જવાનું દુખ થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં કલ્યાંત મચાવ્યો હતો થોડીવારમાં આખા હોસ્પિટલનું વાતાવરણ ગમગીન થઈ ગયેલ હતું. ડોક્ટર દ્વારા મૃતક વ્યક્તિને હોસ્પિટલ માંથી લઈ જવામાં ન આવતા રાત્રીના અચ્ચાર વાગે પોલીસને આ અંગે હેભિત રજૂઆત કરી હતી. હોસ્પિટલ ખાતે દાખલ દર્દીનું મોત થતાં તેમના સમાજના આગેવાનો તેમજ પરિવારજનોમા અમુક વ્યક્તિઓને ડોક્ટરની ભૂલ હોવાનું કહી લાશ સ્વીકારવાની ના પાડતાં હતાં તો કેટલાક

વ્યક્તિ ડોક્ટર મૃતક વ્યક્તિના પરિવારજનો ને અંતિમવિધિ માટે ખર્ચ આપે તેવી રજૂઆતો જોવા મળતી હતી. મૃતક વ્યક્તિના પરિવારજનોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ડોક્ટર અંતિમવિધિ માટે મદદરૂપ બને તેવી રજૂઆત ઉપસ્થિત લોકો કરતાં હતાં. ડોક્ટર અને મૃતકના પરિવારજનો વચ્ચે મનમેળ ન બેસતા હોસ્પિટલ બહાર ઉપસ્થિત લોકોમાં ઉગ્રતા જોવા મળી હતી. હોસ્પિટલ બહાર ઉગ્રતા જોવા મળતા પોલિસ બહાર ગઈ હતી ત્યારે પોલિસે જોયું કે બહાર રોડ પર ઉભી રહેલી વ્યક્તિઓ કોઈપણ કારણો વગર એકમેક થી છૂટા હાથની મારામારી કરી રહેલ હતા.પોલિસ દ્વારા ઉપસ્થિત સહુ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહેલ હતા. પોલિસ દ્વારા અશાંતિ ન ફેલાય તેમજ પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે બળ પ્રયોગ કરી ચાર વ્યક્તિઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સંજીવની હોસ્પિટલના ડોક્ટર પાસે જવાબ લઈ મૃતક વ્યક્તિના પાર્થિવ દેહને પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો. દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પી.એમ કરવામાં આવતા ત્યાં પી.એમનો રિપોર્ટ વધુ જાંચ માટે સુરત મોકલવામાં આવેલ છે તેવું જાણવા મળેલ હતું.

આજનું રાશિ ભવિષ્ય.....

મેષ (અ,લ,ઘ) :

આજે તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. જો ભવિષ્ય માં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજ થીજ ધન ની બચત કરો. આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રેક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ. આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો. આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે.

સિંહ (મ,ર) :

આજે તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કડ્ડણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો. એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે- એપહી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે. તમારા ધન સંચિત કરવા ના પ્રયાસ આજે અસફળ થથી શકે છે. પરંતુ ઘબરાવાની જરૂર નથી કેમકે પરિસ્થિતિ જલ્દી સુધરશે?

ધન (ભ,ધ,ફ) :

આજે તમારે સ્વાસ્થયની ખાસ સંભાળ લેવાની જરૂર છે અને પરિસ્થિતિને થાળે પાડો. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. આજે રોમાન્સની આશા નથી. વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે.

વૃષભ (બ,વ,ઉ) :

આજે તમારે જાતે જ પોતાની દવા કરવી એ બાબત ડૂંગ રિપેન્ડન્સીનું કારણ બની શકે છે. કોઈપણ દવા લેવા પૂર્વે કિઝિશિયનની સલાહ લો અન્યથા ડૂંગ રિપેન્ડન્સીની શક્યતા ખાસ્સી વધારે છે. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો.

કન્યા (પ,ફ,ણ) :

આજના દિવસે તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. કેટલાક લોકો માટે પ્રવાસ દોડામણભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-આપ આર્થિક રીતે વળતર આપશે. પોત્ર-પોત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે.

મકર (ભ,જ) :

સંતોષી જીવન માટે તમારી માનસિક દંઢતામાં વધારો કરો. આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું આશીર્વાદ લો. આના થી તમને ધન લાભ થથી શકે છે. આજે તમે તમારા પરિવારમાં શાંતિદ્રુતનું કામ કરશો. પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો. રોમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે.

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

વડાપ્રધાનશ્રીએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’ નો વિચાર આપ્યો છે, આ ક્ષેત્રે બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ



। (માહિતી) અમદાવાદ, તા.૧૬ ।

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા) દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે.

જ્ઞાન ઉપાસક બ્રહ્મ સમાજ આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે.

બ્રાહ્મણ સમાજ મશીન સંચાલિત કૃત્રિમ બુદ્ધિ - એઆઈથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે. બ્રાહ્મણ સમાજની જ્ઞાન વિરાસતને આધુનિક યુગનાં પરિમાણો સાથે જોડીને વડાપ્રધાનશ્રીની ‘વિરાસત ભી, વિકાસ ભી’ની ભાવના ચરિતાર્થ કરવા મુખ્યમંત્રીશ્રીએ બ્રહ્મસમાજને આ તકે આઘ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલાં ગુજરાતમાં શરૂ કરાવેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ આજે આઈડિયાઝ એક્સચેન્જ માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત’માંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો, ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે. એવી જ રીતે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ-વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે, એવું તેમણે ઉમેર્યું હતું.

‘સરકારના પ્રયાસમાં જ્યારે સમાજના પ્રયાસ ભળે છે, ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે’ એવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાતને યાદ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ ચોથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ વડાપ્રધાનશ્રીના એ વિચારને સાકાર કરે છે.

આ સમિટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌના સાથ, સૌના વિકાસ’ મંત્રને પણ સાકાર કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું. આ સમિટ- માં લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ જાણકારી મળવાની છે. આ બિઝનેસ મહાકુંભમાં ૨૦૦થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાઓ માટે રોજગાર મેળાનું આયોજન થયું છે. સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન મળી રહેશે. આવા આયોજન માટે મુખ્યમંત્રીશ્રીએ સમિટના આયોજકો અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મોદી ૩.૦માં ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર છે. વિશ્વનું સૌ પ્રથમ અર્થશાસ્ત્ર રચનારા ચાણક્યને યાદ કરીને તેમણે જણાવ્યું કે શિક્ષણ અને નોકરી ઉપરાંત બ્રહ્મસમાજ ઉદ્યોગ, વેપાર-વાણિજય ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યો છે.

બ્રહ્મ સમાજના ઉદ્યોગકારો, વ્યાવસાયિકો દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપશે એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી. ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં બ્રહ્મશક્તિની તાકાત અને આ સમિટનું યોગદાન મહત્ત્વના બની રહેશે, એવો વિશ્વાસ વ્યક્ત કરી મુખ્યમંત્રીશ્રીએ સમિટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે બ્રાહ્મણ સમાજને વ્યાપાર વણજના માર્ગે આગળ લઈ જવા માટેના આયોજનને બિરદાવ્યું હતું.

દેશના મંદિરો, સંસ્કારો, સંસ્કૃતિની રક્ષા કરનારા સમાજે દેશના અર્થતંત્રને ગતિ આપવાનું મહાકાર્ય કરી રહ્યા છે ત્યારે સૌ જરૂર સફળ થશે તેવી શુભકામના તેમણે પાઠવી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સંસ્થાના મહામંત્રી શ્રી ગિરીશ ત્રિવેદીએ બ્રાહ્મણ બિઝનેસ સમિટની પરંપરાના હેતુ અને ભાવિ લક્ષ્યો વર્ણવ્યા હતા. તેમજ ડો. યજ્ઞેશ દવેએ સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ સમિટના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ બ્રહ્મ સમાજના વ્યાપારીઓ, મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ ને પ્રોત્સાહન આપ્યું હતું.

આ સમિટમાં પૂર્વ રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર, મધ્ય પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી શ્રી રાજેન્દ્ર શુક્લા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ, ઉત્તરાખંડ રાજ્ય સરકારના મંત્રી શ્રી સુબોધ ઉન્નાયલ, સાંસદ શ્રી શશાંકમણિ ત્રિપાઠી, શ્રી મયંક નાયક, ગુજરાત નાણા પંચના અધ્યક્ષ શ્રી યમલ વ્યાસ, ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટ, શ્રી અમિત ઠાકર, નાટયકાર અને અભિનેતા મનોજ જોષી, તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા)ના આગેવાનો, બિઝનેસ અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ખાદી મહોત્સવ – ૨૦૨૫ । ઓર્ગેનિક મસાલાઓની લોકો કરી રહ્યા છે બમ્પર ખરીદી મુંબઈથી વેચાણ અર્થે વડોદરા આવેલા ચંદ્રકાંત ભાઈ વેચે છે વિવિધ પ્રકારના ઓર્ગેનિક મસાલા



। (માહિતી) વડોદરા, તા.૧૬ ।

શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પારસી અગિયારી ગ્રાઉન્ડ ખાતે ખાદી મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે અહીં ગ્રામોદ્યોગના ૩૨ સ્ટોલ પર સ્વદેશી અને ગુણવત્તાયુક્ત વસ્તુઓની લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે.

તા. ૨૨ માર્ચ સુધી ચાલનારા આ ખાદી મહોત્સવમાં મુંબઈથી ચંદ્રકાંતભાઈ પોતાના વિવિધ પ્રકારના સ્વદેશી મસાલા વેચાણ અર્થે લાવ્યા છે. તેઓ પોતાના સ્ટોલમાં ઘરે બનાવેલા કોઈ પણ કેમિકલ વગરના વિવિધ પ્રકારના મસાલા રાખે છે. વડોદરાના સ્વાદપ્રિય લોકો આ સ્વદેશી મસાલાની ધૂમ ખરીદી કરી રહ્યા છે.

પંકજભાઈ અગ્રવાલની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરાઈ ઝાલોદ અગ્રવાલ સમાજની સાધારણ સભા યોજાઈ : નવી કારોબારીની નિમણૂક કરાઈ

। (પ્રતિનિધી) ઝાલોદ, તા.૧૬ ।

ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા પ્રતિવર્ષ ધૂળેટીના અવસરે સ્નેહ મિલનનુ આયોજન કરવામાં આવતું હોય છે. આજની સ્નેહ મિલન ગોઠ પહેલા અગ્રવાલ સમાજની સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભામાં સમાજની પ્રગતિ, ઉન્નતિ માટેના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ સમાજને હિતને લઈ વિચાર વિમર્શ તેમજ સુઝાવો લેવામાં આવ્યા હતા. સમાજના ગુજરાત કક્ષાએ દિલીપભાઈ અગ્રવાલ અને નાથુલાલજી અગ્રવાલ બે ફાઉન્ડર સભ્ય બન્યા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પંકજ અગ્રવાલ ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી ઈન્ચાર્જ બની નગરપાલિકામાં ભાજપને જીતાડી બોર્ડ બનાવ્યું તેમજ સમય સમય પર સમાજને દરેક ક્ષેત્રે કામ લાગતા હોઈ તેમના કાર્યોની સરાહના કરી બિરદાવવામા આવ્યું હતું.

આજની સામાન્ય સભામાં સમાજને સમય અને સમાજ સાથે દરેક ક્ષેત્રે જોડાઈ આગળ લાવી શકે તે માટે નવી કારોબારી બનાવવા માટે સ્વેચ્છાએ

ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને તાકીદ

અમદાવાદ ખાતે કલેક્ટર સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

। (માહિતી) અમદાવાદ, તા.૧૬ ।
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટર શ્રીએ સર્બપિત અધિકારીઓને સૂચના આપી સત્વરે કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા વિરમગામ,

આવી જ રીતે ગ્રામોદ્યોગના અન્ય સ્ટોલ્સ પર પણ અથાણાં, જામ, મધ, અગરબત્તી, આયુર્વેદિક અને વિવિધ પ્રકારના હર્બલ ઉત્પાદનોનું વેચાણ થઈ રહ્યું છે. ચંદ્રકાંતભાઈએ ખાદી મહોત્સવના આયોજનથી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળતું હોવાનું જણાવી, ખૂબ વેચાણ બદલ વડોદરાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે આ પ્રકારના આયોજન થકી તેમને થઈ રહેલી સારી આવકનો સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ આ ખાદી મહોત્સવના આયોજન બદલ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સરાહના કરી હતી.



નામ રજૂ કરવા સૂચન કરવામાં આવ્યું હતું અને સમાજના સૂચન થી નવી કારોબારીમાં યુવા વર્ગને પણ સ્થાન આપવામાં આવ્યું હતું જેથી આવનાર સમયમાં યુવાઓ સમાજને વધુ આગળ લાવી શકે. નવી કારોબારીમાં સોળ વ્યક્તિઓના નામ આવ્યા હતા જેમાં અચ્ચાર સમાજના વરિષ્ઠ આગેવાનો અને પાંચ યુવા વર્ગ માંથી પસંદ કરવામાં આવેલ હતા. કારોબારીના સોળ મેમ્બર દ્વારા મીટિંગ યોજી સર્વાનુમતે પંકજ અગ્રવાલને પ્રમુખ, મનોજ અગ્રવાલને ઉપપ્રમુખ , મંત્રી સમાજના જૂના અને જાણીતા મુરબબી દિલીપ અગ્રવાલ, હસભંત્રી યુવા વર્ગ માંથી કૃષ્ણાલ અગ્રવાલ અને ખજાનચી તરીકે રિતેશ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હતી.

ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને તાકીદ

અમદાવાદ ખાતે કલેક્ટર સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

। (માહિતી) અમદાવાદ, તા.૧૬ ।
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટર શ્રીએ સર્બપિત અધિકારીઓને સૂચના આપી સત્વરે કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા વિરમગામ,

IPL ૨૦૨૫ પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો મોટો ઝટકો

। (એજન્સી) મુંબઈ, તા.૧૬ । જસપ્રિત બુમરાહ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ ની પ્રારંભિક મેચો નહીં રમી શકે તેવી શક્યતા છે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ફાસ્ટ બોલર હજુ પણ પીઠની નીચેની ઈજામાંથી સાજા થઈ રહ્યો છે. જાન્યુઆરી બુમરાહ સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી બહાર છે. બુમરાહ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો અને તે બીજી ઈનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે રમાયેલી આ શ્રેણીમાં બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૩૨ વિકેટ લીધી હતી પરંતુ તે પછી તે કોઈ મેચ રમી શક્યો ન હતો. ઈજાના કારણે તે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભાગ લઈ શક્યો ન હતો જેમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. સૂરોના જણાવ્યા અનુસાર, તેની ઈજામાંથી રિકવરી સારી છે, પરંતુ જૂનમાં ઈંગ્લેન્ડ સામેની ભારતની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને તેને સંપૂર્ણ ફિટનેસ મેળવવા માટે આ તબક્કે થોડો વધુ સમય આપવો વધુ સારું રહેશે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં રોહિત જ કેપ્ટન

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ જીત્યા બાદ રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશિપને જીવનદાન મળી ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે જૂનથી ઓગસ્ટ વચ્ચે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં રોહિત જ કેપ્ટન રહેશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ત્યારબાદ રોહિત શર્મા પર સવાલો ઉઠવા લાગ્યા હતા. સિડની ટેસ્ટમાં તો રોહિતે ખુદ બહાર બેસવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં બુમરાહે ટીમની કમાન સંભાળી હતી. હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ રોહિતને બીસીસીઆઈનું સમર્થન મળ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે બોર્ડ અને પસંદગીકારોએ રોહિતને વધુ એક મોટા પ્રવાસ પર કેપ્ટન તરીકે મોકલવાનો નિર્ણય લીધો છે. બોર્ડનું કહેવું છે કે રોહિતે સાબિત કરી દીધું કે તે શું કરી શકે છે. બધાને લાગે છે કે ઈંગ્લેન્ડના પ્રભાવ પર તે ભારતનું નેતૃત્વ કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે. રોહિતે હજુ ટેસ્ટ ક્રિકેટમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિતે ખુદ કહ્યું હતું કે તે નિવૃત્તિ લઈ રહ્યો નથી. પરંતુ જ્યારે તેને ૨૦૨૭ વનડે વિશ્વકપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે પોતાની યોજનાનો ખુલાસો કર્યો હતો.

IPL પહેલા પરિવાર સાથે માલદીવ

પહોંચ્યો રોહિત શર્મા । (એજન્સી) માલદીવ, તા.૧૬ । ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી, રોહિત શર્મા હાલમાં તેના પરિવાર સાથે માલદીવમાં છે, જ્યાં તે વેકેશન માણી રહ્યો છે. રોહિત શર્મા તાજેતરમાં દુબઈથી પાછો ફર્યો છે, જ્યાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહ્યું હતું અને ન્યુઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. પોતાની IPL ટીમમાં જોડાતા પહેલા, રોહિત શર્મા તેની પત્ની, પુત્રી અને પુત્ર સાથે રજાઓ મનાવવા માલદીવ ગયો હતો. રોહિત શર્માએ પોતે આ જગ્યાની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભારતે તાજેતરમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. રોહિતે ફાઈનલમાં ૭૬ રનની મેચ વિનિંગ ઈનિંગ રમી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. રોહિત દુબઈ પહેલા મુંબઈ પહોંચ્યો, જ્યાં તેના સ્વાગત માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા. ત્યાંથી તે પોતાના પરિવાર સાથે માલદીવ પહોંચ્યો.



આસામના કેરગાંવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લચિત બરફૂન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ભાજપ પ્રમુખ પદેથી નહ્તાની વિદાય નક્કી ચાર રાજ્યોમાં સંગઠનની ચૂંટણીના ફારણે નવી નિયુક્તિમાં વિલંબ શક્ય છે કે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ૬ એપ્રિલ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થશે

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ ।

ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે? આની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. એવા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની બેંગલુરુ બેઠક પહેલા ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબના કારણે હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાતમાં વધુ અટકી ગઈ છે. જ્યારે જેપી નકાએ લોકસભાની ચૂંટણીમાં કહ્યું હતું કે, સંઘની કોઈ જરૂર નથી ત્યારે ઘણો વિવાદ થયો હતો. યુનિયન આવી સ્થિતિનું પુનરાવર્તન પૂર્ણ કરી શકી નથી. જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. ચાર મોટા રાજ્યોમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ અને



જિલ્લા પ્રમુખોની યાદી અટવાઈ જવાને કારણે રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત પણ અટકી ગઈ છે. જ્યારે જેપી નકાએ લોકસભાની ચૂંટણીમાં કહ્યું હતું કે, સંઘની કોઈ જરૂર નથી ત્યારે ઘણો વિવાદ થયો હતો. યુનિયન આવી સ્થિતિનું પુનરાવર્તન પૂર્ણ કરી શકી નથી. જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. ચાર મોટા રાજ્યોમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ અને

દિવસ ૬ એપ્રિલ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. ભાજપ ના બંધારણ મુજબ અડધા રાજ્યોમાં સંગઠનની ચૂંટણી થાય ત્યારે જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. એટલું જ નહીં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જરૂરી ઈલેક્ટોરલ કોલેજની પણ રચના કરવી જોઈએ. અડધા રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થાય ત્યારે જ તેની રચના થાય છે. દરેક રાજ્ય પાસે આ માટે ક્વોટા છે. આમાં સૌથી વધુ ભાગીદારી યુપીની છે. યુપીના ઈલેક્ટોરલ કોલેજમાં ક્વોટા ૭૫ સભ્યોનો છે. યુપીમાં હજુ સુધી જિલ્લા પ્રમુખોની યાદી બહાર પાડવામાં આવી નથી. હવે જોઈએ કે આગામી થોડા દિવસોમાં કોઈ પ્રગતિ થાય છે કે નહીં.

ખેલાડીઓએ ખૂબ એન્જોય કર્યું હોળી પર ફુલ મૂડમાં જોવા મળ્યા સચિન, યુવરાજ સિંહના રૂમમાં ઘૂસી તૂટી પડ્યા IPL તૈયારીમાં જોડાયેલા ભારતીય ક્રિકેટર્સે હોળી મનાવી

। (એજન્સી) રાયપુર, તા.૧૬ ।

હોળીનો તહેવાર આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ દરમ્યાન કેટલીય સેલિબ્રિટી પણ આ તહેવારોને ખૂબ એન્જોય કરતી જોવા મળી. જેમાં ક્રિકેટર્સ પણ બાકાત નથી. ત્યારે હવે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકર ટીમ ઈંડિયાના ખેલાડીઓ સાથે હોળી રમતા જોવા મળ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હોળીના દિવસે સચિન તેંડુલકર મોટી પિચકારી સાથે દેખાયા હતા. તેઓ હોળી રમવા માટે સૌથી પહેલા યુવરાજ સિંહના રુમમાં જાય છે, ત્યાર બાદ તેમણે ટીમના અન્ય ખેલાડીઓ સાથે પણ હોળી રમી હતી. સચિને વીડિયોમાં જણાવ્યું કે, પહેલા



યુવરાજ સિંહના રુમમાં જઈ રહ્યા છીએ, ત્યાં તેમની સાથે હોળી રમીશું. યુવરાજ સિંહ ઉઠીને પોતાના રુમનો દરવાજો ખોલે છે, તો બધા મળીને તેના પર ખૂબ રંગ લગાવે છે. આ પ્રેક્ષમાં સચિનની સાથે સૌરભ તિવારી, યૂસુફ પઠાણ અને રાહુલ શર્મા પણ તેમનો સાથ આપે છે. સચિન તેંડુલકરે વીડિયોમાં કહ્યું કે, પાણીની ગન એકદમ લોડેડ છે. યુવરાજ સિંહ સાહેબના રુમમાં જઈ રહ્યા છીએ, કાલે રાતે બહુ છગ્ગા માર્યા. હવે અમે મારવા જઈ રહ્યા છીએ.

યુદ્ધવિરામની ચર્ચા વચ્ચે પુતિનનું નિવેદન આત્મસમર્પણ કરી દો તો યુક્રેનના સૈનિકોના જીવ બક્ષી દેવામાં આવશે યુક્રેનના સૈનિક હથિયાર હેઠા મૂકવાનો ઇનકાર કરે છે, તો તે બધાને નિર્દયતાપૂર્વક ખતમ કરી દેવામાં આવશે

। (એજન્સી) મોસ્કો, તા.૧૬ ।

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૧૪ માર્ચ) વ્લાદિમીર પુતિનને રશિયા દ્વારા કુર્ક સેનમાંથી પાછા ખેંચવામાં આવી રહેલા યુક્રેનના સૈનિકોને મુક્ત કરવા કહ્યું હતું. જેના પર પુતિનની પ્રતિક્રિયા સામે આવી છે. પુતિને કહ્યું કે, જો આ (યુક્રેનના સૈનિક) આત્મસમર્પણ કરે છે તો આ અપીલનું સન્માન કરીશ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પુતિને કહ્યું કે, જો યુક્રેનના સૈનિક આત્મસમર્પણ કરે છે, તો અમે ગેરંટી આપીએ છીએ કે, અમે તેમનો જીવ બચાવી લઈશું. તેમને આંતરરાષ્ટ્રીય કાયદો અને રશિયાના કાયદા અનુસાર જીવન અને સભ્ય વ્યવહારની ગેરંટી આપવામાં આવશે. વળી, રશિયાના સુરક્ષા



પરિષદના ઉપાધ્યક્ષ, પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, જો યુક્રેનના સૈનિક હથિયાર હેઠા મૂકવાનો ઈકાર કરે છે, તો તે બધાને નિર્દયતાપૂર્વક ખતમ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, એક દિવસ પહેલાં પુતિન સાથે થયેલી લાંબી સકારાત્મક ચર્ચા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાની ઘણી સંભાવના છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટૂથ પર પોસ્ટ કરીને કહ્યું કે, આવતીકાલે રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પ

ુતિન સાથે ખૂબ સારી અને ઉપયોગી ચર્ચા થઈ હતી. આ વાતચીત પરથી ઘણી સંભાવના છે કે, આ ભયાનક અને લોહીલોહાણ યુદ્ધ ખતમ થઈ જશે. મેં પુતિનને અનુરોધ કર્યો છે કે, સંપૂર્ણ રીતે ઘેરાયેલા યુક્રેનના સૈનિકોને બંધી દે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમેરિકાના વિટકોફે પણ ગુરુવારે રાત્રે મોસ્કોમાં પુતિન સાથે લાંબી બેઠક કરી હતી. જોકે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટૂથ પર ટ્રમ્પે જણાવ્યું નથી કે, પુતિન સાથે સીધી વાત થઈ હતી કે નહીં. કેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે, પુતિને વિટકોફના માધ્યમથી ટ્રમ્પને સંકેત આપ્યા હતા. વિટકોફ દ્વારા ટ્રમ્પે જાણકારી આપ્યા બાદ રશિયા અને અમેરિકા પોતાના નેતાઓ વચ્ચે ફોન કોલની વ્યવસ્થા કરશે.

દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી આખરે ઠાર

। (એજન્સી) વોશિંગટન, તા.૧૬ । અમેરિકાના મિસાઈલ હુમલામાં ISIS ના ગ્લોબલ ઓપરેશન હેડ અબ્દુલ્લા મક્કી મુસ્લીહ અલ-રિકાઈના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યાં છે. અલ રિકાઈને અમેરિકાએ ઈરાકી ખાનગી અને સુરક્ષા દળોની સાથે મળીને ઠાર માર્યો છે. અબ્દુલ્લા મક્કી મુસ્લીહ અલ-રિકાઈ, જેને અબુ ખાદીજાના નામથી પણ ઓળખવામાં આવે છે. અબુ ખાદીજા તથાકથિત ઈસ્લામિક સ્ટેટ માટે ગ્લોબલ ઓપરેશન હેડ તરીકે કામ કરી રહ્યો હતો. અમેરિકાના આ હુમલામાં ISISના ઘણા અન્ય આતંકવાદી પણ માર્યા ગયા છે. આ હુમલાને લઈને અમેરિકી સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે અબુ ખદીજાએ દુનિયાભરમાં આતંકવાદી જૂથની લોજિસ્ટિક્સ, યોજના અને નાણાકીય મેનેજમેન્ટની સારસંભાળ કરી. હવાઈ હુમલા બાદ યુએસ સેન્ટ્રલ કમાન્ડ અને ઈરાકી સેનાઓ ઘટના સ્થળે પહોંચી.

પોલીસે જઈને ચેક કર્યું તો ૬૬ છોડ મળી આવ્યા મહારાષ્ટ્રમાં એક મહિલાએ ખેતરમાં અફીણની ખેતી કરી પોલીસે દરોડા દરમ્યાન અફીણના પાકને જમ કર્યો અને ખેતી કરનારી મહિલાની પણ ધરપકડ કરી છે

। (એજન્સી) પુણે, તા.૧૬ ।

મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચૌકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ ખેતીના નામ પર રોડના કિનારે અફીણની ખેતી શરુ કરી દીધી હતી. જ્યારે તેની જાણ પોલીસને થઈ તો તમામ લોકો ચોંકી ગયા. તાત્કાલિક પોલીસે ખેતરમાં દરોડા પાડ્યા અને કાર્યવાહી કરી, જેમાં આખું ખેતર અફીણથી ભરેલું હતું. પોલીસે દરોડા દરમ્યાન અફીણના પાકને જમ કર્યો અને ખેતી કરનારી મહિલાની પણ ધરપકડ કરી છે. આખો મામલો પુણેના આલંદીમાં રોડ કિનારે આવેલા ખેતરનો છે. આલંદી મહાતોબા ગામ વિસ્તારમાં અફીણની ખેતી થતી હતી. લોની કાલભોર



પોલીસે મહિલા વિરુદ્ધ નશીલા પદાર્થની ખેતી કરવાનો કેસ નોંધી લીધો છે. લોની કાલભોર પોલીસને સૂચના મળતા જ આલંદી મહાતોબામાં રોડ કિનારાની અફીણથી ભરેલું હતું. પોલીસે દરોડા કરી. તેના પર પોલીસ સ્થળ પર જઈને દરોડા પાડ્યા તો ત્યાં ૬૬ અફીણના છોડ કરી છે. આખો મામલો પુણેના આલંદીમાં રોડ કિનારે આવેલા ખેતરનો છે. આલંદી મહાતોબા ગામ વિસ્તારમાં અફીણની ખેતી થતી હતી. લોની કાલભોર

લોકલ સર્કલ્સ સર્વેએ જણાવી ઊંઘની કહાની ભારતમાં ૫૯ ટકા લોકોને ૬ કલાક પણ સરખી ઊંઘ જ નથી આવતી ૫૯ ટકા ભારતીય ૬ કલાકથી ઓછી સતત ઊંઘ મેળવી રહ્યાં છે તેમાંથી ૩૮ ટકા લોકો વીકેન્ડે પણ ઊંઘ પૂરી કરી શકતાં નથી

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ ।

શું તમે પૂરતી ઊંઘ લઈ શકો છો? આ સવાલના જવાબમાં મોટાભાગના લોકો કહેશે ના. મોટાભાગના લોકોનું કહેવું હોય છે કે પૂરતી ઊંઘ ક્યાં? ખૂબ મુશ્કેલથી તો ઊંઘ આવે છે અને પછી થોડા જ સમયમાં તૂટી પણ જાય છે. પછી સવારથી સોજ સુધી કામ, ખાવાનું અને પછી રાત્રે બેડ પર ગયા બાદ કાલના કામની ચિંતા. પૂરતી ઊંઘ ન લેવી હેલ્થની દ્રષ્ટિએ ખૂબ મોટી ચિંતા છે પરંતુ મોટાભાગના ભારતીયોની ઊંઘ ઊંડી ગઈ છે. પરિણામે બ્લડ પ્રેશર, હાઈપરટેન્શન, અનિદ્રા જેવી ઘણી બિમારીઓ ઝડપથી વધી રહી છે. દર વર્ષે ૨૧ માર્ચ (જ્યારે દિવસ અને રાત સમાન હોય છે) થી પહેલા શુક્રવારે વર્લ્ડ



સ્લીપ ડે મનાવવામાં આવે છે. ૧૪ માર્ચે હોળીના દિવસે આ વખતે વર્લ્ડ સ્લીપ ડે મનાવાયો. વર્લ્ડ સ્લીપ ડે પહેલા લોકલ સર્કલ્સે એક સર્વે દ્વારા ભારતીયની ઊંઘની કહાની જણાવી હતી. હેલ્થની દ્રષ્ટિએ ખૂબ મોટી ચિંતા છે પરંતુ મોટાભાગના ભારતીયોની ઊંઘ ઊંડી ગઈ છે. પરિણામે બ્લડ પ્રેશર, હાઈપરટેન્શન, અનિદ્રા જેવી ઘણી બિમારીઓ ઝડપથી વધી રહી છે. દર વર્ષે ૨૧ માર્ચ (જ્યારે દિવસ અને રાત સમાન હોય છે) થી પહેલા શુક્રવારે વર્લ્ડ

જિલ્લાના રહેવાસી છે. જેમાં ૬૧ ટકા પુરુષ અને ૩૮ ટકા મહિલાઓ છે. આ લોકોને પૂછવામાં આવ્યું કે ગયા એક વર્ષમાં તમે લોકોએ રાત્રે કેટલા કલાકની સતત ઊંઘ લીધી છે. ૧૫૬૮૮ લોકોએ આ સવાલનો જવાબ આપ્યો. ૩૮ ટકા લોકોએ ૬-૮ કલાકની ઊંઘ લેવાની વાત કહી. ૩૮ ટકા લોકોએ ૪-૬ કલાકની ઊંઘની વાત કહી. ૨૦ ટકા લોકોએ લગભગ ૪ કલાકની ઊંઘની વાત કહી. બે ટકા લોકોએ ૮-૧૦ કલાકની ઊંઘ લેવાની વાત કહી. કુલ મળીને ૫૯ ટકા લોકો એવા મળ્યા જેમણે એ પણ કહ્યું કે ૬ કલાકની અવિરત ઊંઘ લઈ રહ્યાં નથી. સર્વેમાં જાણવા મળ્યું કે ઊંઘમાં વારંવાર બેસવ પડવાની પાછળ સૌથી મોટું કારણ અડધી રાત્રે બાથરુમ ટ્રિપ્સ છે.

આગામી ૩થી૪ દિવસ આફરી ગરમીની આગાહી

। (એજન્સી) અમદાવાદ, તા.૧૬ ।
રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગામી મુજબ તાપમાનમાં આંશિક ઘટાડા બાદ ફરી એક વાર તાપમાનના પારો રથી ૩ ડીગ્રી ઉચ્ચે થતાં કાળઝાળ ગરમી અનુભવાશે. આગામી ૩થી૪ દિવસ આફરી ગરમીની આગાહી કરાવમાં આવી છે. નોંધનિય છે કે, રાજસ્થાનમાં સર્જાયેલ સાયકલોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયકલોનિક સરક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટૂર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો છે.ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ૧૮



માર્ચ બાદ વધુ ગરમી અનુભવાશે, આ સમય ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. કેટલાક શહેરોનું દરમિયાન દિવસ અને રાત્રિના તાપમાનમાં ૨થી ૪ તાપમાન ૪૦ ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.

પાટણ શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે. અહીં સવારથી આફરી ગરમી અનુભવાય. સવારે તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી દિવસોમાં ૪ ડિગ્રી તાપમાનનો પારો ઉંચે જવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. જેના કારણે ગરમી ૪૨ ડીગ્રીને આંબે તેવી શક્યતા છે. ખાસ કરીને આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમી વધવાનું અનુમાન છે.
રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન ૩૬ ડિગ્રીને પાર ગયું છે.અમદાવાદમાં ૩૭.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૭.૬ ડિગ્રી,ડીસામાં ૩૬.૬ ડિગ્રી, વડોદરામાં ૩૭.૬ ડિગ્રી,સુરતમાં ૩૭.૨, ભુજમાં ૩૬.૭ ડિગ્રી,અમરેલીમાં ૩૮.૧ ડિગ્રી, પોરબંદરમાં ૩૨.૨ ડિગ્રી,ભાવનગરમાં ૩૬.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭.૩ ડિગ્રી,મહુવામાં ૩૫.૬ ડિગ્રી, કેશોદમાં ૩૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ૩૬ ડિગ્રી, કેશોદમાં ૩૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન ૩૬ ડિગ્રીને પાર ગયું છે.અમદાવાદમાં ૩૭.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૭.૬ ડિગ્રી,ડીસામાં ૩૬.૬ ડિગ્રી, વડોદરામાં ૩૭.૬ ડિગ્રી,સુરતમાં ૩૭.૨, ભુજમાં ૩૬.૭ ડિગ્રી,અમરેલીમાં ૩૮.૧ ડિગ્રી, પોરબંદરમાં ૩૨.૨ ડિગ્રી,ભાવનગરમાં ૩૬.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭.૩ ડિગ્રી,મહુવામાં ૩૫.૬ ડિગ્રી, કેશોદમાં ૩૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ૩૬ ડિગ્રી, કેશોદમાં ૩૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ VCએ રૂપિયા ૬૪૨૦૦ ભાડું ચૂકવવું પડશે

। (એજન્સી) વડોદરા, તા.૧૬ ।
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવે અહીં મહિના બાદ વાઈસ ચાન્સેલરનો સત્તાવાર બંગલો ખાલી કર્યો છે. જોકે બંગલામાં રહેવા માટે તેમણે કુલ મળીને ૬૪૨૦૦ રૂપિયા ભાડું ચૂકવવું પડશે. સૂત્રોનું કહેવું છે કે, હજી સુધી તો ડો.શ્રીવાસ્તવે કોઈ ભાડું આપ્યું નથી. ડો.શ્રીવાસ્તવે તા.૮ જાન્યુઆરીએ રાજીનામું આપ્યા બાદ તેમને બંગલામાં રહેવા માટે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે એક મહિનાનું એક્સ્પેન્શન આપવામાં આવ્યું હતું. આ એક મહિના માટેનું ભાડું ૧૨૦૦ રૂપિયા ગણવામાં આવ્યું છે. સાથે જ બાદમાં બજાર ભાવે ભાડું વસુલવાની ગણતરી કરાઈ હતી. પરંતુ એ પછીના સમય માટે યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના પરિપત્રને ધ્યાનમાં રાખીને બજાર ભાવ પ્રમાણે ભાડાની ગણતરી કરવામાં આવી છે. જે અનુસાર ફેબ્રુઆરી મહિના માટે તેમણે ૪૨૦૦૦ રૂપિયા અને માર્ચ મહિનાના પંદર દિવસ માટે ૨૧૦૦૦ રૂપિયા ભાડું ચુકવવાનું થાય છે. આમ કુલ મળીને તેમને ૬૪૨૦૦ રૂપિયા ભાડું આપવું પડશે. સૂત્રોનું કહેવું છે કે, ડો.શ્રીવાસ્તવે હજી ૮૫૦૦૦ રૂપિયા જેટલો પગાર લેવાનો બાકી નીકળે છે. જો સત્તાધીશો ધારે તો બંગલાનું ભાડું તેમાંથી પણ વસુલવાની કાર્યવાહી કરી શકાય તેમ છે.

સુરતમાં વૃદ્ધ સિક્ચોરિટી ગાર્ડ સાથે દાદાગીરી

। (એજન્સી) સુરત, તા.૧૬ ।
રાજ્યમાં અસામાજિક તત્વો અને માથાભારે લોકો દ્વારા દાદાગીરીની ઘટના સતત વધતી જાય છે. રાજ્યના અલગ વિસ્તારોમાંથી દરરોજ દાદાગીરીના વીડિયો સામે આવે છે, ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાંથી માથાભારે ઈસમો દ્વારા સિક્ચોરિટી ગાર્ડને નિર્દયતા પૂર્વક માર મારવાની ઘટના સામે આવી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપીઓની કારનો નંબર પોલીસ પાસે હોવાથી આરોપીઓને ઝડપથી શોધી કાઢવામાં મદદ મળશે. ગ્રામ માહિતી અનુસાર સુરત શહેરનાઆનંદમહેલ રોડ પર આવેલી માલવિયા હોસ્પિટલમાં સિક્ચોરિટી તરીકે ફરજ બજાવતા ૭૭ વર્ષીય ભાઈલાલભાઈ પ્રજાપતિ શનિવારે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કાર લઈને આવેલા બે ઈસમોએ હોસ્પિટલના પાર્કિંગમાં ઉભા રહીને પેશાબ કરવા લાગ્યા હતા.

વિરોધમાં રસ્તા પર ઉતર્યો ઠાકોર સમાજ!

ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને બનાસકાંઠામાં રોષ જોવા મળ્યો

। (એજન્સી) પાલનપુર, તા.૧૬ ।
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને બનાસકાંઠામાં રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર દેખાવ કર્યા હતા. આખુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા હતા. વિરોધ કરનારાઓએ વિધાનસભા અધ્યક્ષશંકર ચૌધરી પર આ મામલે નિશાન સાધ્યું હતું. અમીરગઢના ઠાકોર સમાજના આગેવાન અરવિંદ ઠાકોરે કહ્યું કે, ‘હાથમાં છે વ્હીસ્કીને આંખોમાં પાણી...’ ગાનાર કલાકારોનું

વિધાનસભા અધ્યક્ષ સન્માન કરે છે. તેમણે ઠાકોર સેનાના કાર્યકરોએ ઠાકોર સમાજના કલાકારોની અવગણના બદલ લઈને બનાસકાંઠામાં રોષ જોવા મળ્યો છે. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે. આ બાબત દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા હતા. વિરોધ કરનારાઓએ વિધાનસભા અધ્યક્ષશંકર ચૌધરી પર આ મામલે નિશાન સાધ્યું હતું. અમીરગઢના ઠાકોર સમાજના આગેવાન અરવિંદ ઠાકોરે કહ્યું કે, ‘હાથમાં છે વ્હીસ્કીને આંખોમાં પાણી...’ ગાનાર કલાકારોનું

કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. દરેક કલાકારનું સ્વાગત કર્યું સારી બાબત છે, મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મેં ધ્યાન દોર્યું છે. કલાકારને નાત-જાત નથી હોતી, સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ. શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારને બોલાવ્યા હતા. સરકારી ઈવેન્ટોમાં પણ ઠાકોર સમાજને સરકારી કામ નથી મળતું. સરકારે ઠાકોર કલાકારને પ્રોત્સાહન આપવું જોઈએ. ઠાકોર સમાજ સહિત દરેક સમાજના ચાહક વર્ગ છે.

સંતોષી માતાના મંદિરના પૂજારીએ ગુપ્ત ટૂંકાવ્યું

। (એજન્સી) અમદાવાદ, તા.૧૬ ।
શહેરના કુબેરનગરમાં આવેલા સંતોષી માતાના મંદિરના પૂજારી મહેન્દ્રભાઈ મિણેકરે જીવન ટૂંકાવ્યું છે. મંદિરના પૂજારીના પુત્રએ આ મામલે મોટો દાવો કર્યો છે કે, બિલ્ડરના ત્રાસને કારણે પિતાએ જીવન ટૂંકાવી લીધું છે. શહેરના કુબેરનગરમાં સંતોષી માતાના મંદિરને તોડવા માટે નોટિસો મળતી હતી. મહંતના પુત્રએ એવું પણ જણાવ્યું છે કે, મંદિરને તૂટતું બચાવવા અને દબાણને કારણે પિતાએ આપઘાત કર્યો છે. આ બનાવ બાદ પોલીસની ટીમ પણ

સ્થળ પર પહોંચીને લઘુ કાર્યવાહી કરી છે. પૂજારીના આપઘાત કેસમાં પોલીસે જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી AMC ઘણી વખત બંદોબસ્ત માંગતું હતું. પોલીસનો રોલ માત્ર લો એન્ડ ઓર્ડર જળવાય એટલો જ હોય છે. AMC બંદોબસ્ત માંગે એટલે પોલીસ બંદોબસ્ત આપે છે. કોઈને ડરાવવા અને ધમકાવવાનો પોલીસનો ઉદ્દેશ્ય નથી હોતો. આક્ષેપો કરવામાં આવ્યા છે એ સાચા છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવશે. આ અંગે પૂજારીના પુત્ર શ્રિજેશે આ અંગે જણાવ્યું છે કે, “અમારે બિલ્ડરનો દબાવ હતો.

સાબરકાંઠાના તલોદમાં UGVCLની બેદરકારીથી ખેતરમાં આગ લાગી

। (એજન્સી) સાબરકાંઠા, તા.૧૬ ।
રાજ્યમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને હાલ ઘઉં લણવાની શરૂઆત પણ થઈ ગઈ છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના તલોદમાં ખેડૂતોના ખેતર ઉપરથી પસાર થતા UGVCLના વીજતારને કારણે ખેતરોમાં ઊભા ઘઉંના પાકમાં આગ લાગી હતી. જેના કારણે ઘઉંનો પાક બળીને રાખ થઈ જતા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.

કુલ ૫૦૦૦ વાહન ચાલકો દંડાયા । વડોદરામાં ૪૫૦ સરકારી કર્મચારીને ફટકારાયો દંડ

। (એજન્સી) વડોદરા, તા.૧૬ ।
ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ વડોદરા શહેરમાં હેલમેટ ન પહેરવા બદલ ૪૫૦ સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં હેલમેટ ન પહેરનારા ૫૦૦૦ વાહન ચાલકો પણ દંડાયા છે. રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા હેલમેટ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૧૫ દિવસની અંદજ લગભગ ૪૫૦ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે ટ્રાફિક પોલીસે કુલ મળીને ૫૦૦૦ વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલમેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. ત્યાર બાદ મંગળવાર (૧૧મી

ફેબ્રુઆરી)થી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં દિવ્યકી વાહનો પર હેલમેટ ફરજિયાત કરાયા છે. હાઈકોર્ટના કડક વલણને પગલે રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં હેલમેટ વગરના કર્મચારીને દંડિત કરવામાં આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓમાં હેલમેટ પાલન અંગે પોલીસ મહાનિર્દેશક (DGP)ના કડક નિર્દેશોને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે ૧૧ ફેબ્રુઆરી-૨૦૨૫ને મંગળવારે સરકારી કચેરીઓની બહાર એક વ્યાપક રૂબેરા શરૂ કર્યું હતું કલેક્ટર ઓફિસ અને પોલીસ કમિશનર ઓફિસ સહિતના મુખ્ય સ્થળોએ હેલમેટ અને સીટબેલ્ટના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ભારે તૈનાતી જોવા મળી હતી. આ કામગીરી દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે કુલ ૬૬૦ કેસ નોંધ્યા અને રૂ.૩.૩૦ લાખ દંડ વસૂલ્યો હતો. નોંધનીય છે કે, પોલીસ અધિકારીઓને પણ બક્ષવામાં આવ્યા ન હતા.

બેફામ ગતિએ કાર ચલાવીને એક ચાલકે રાહદારીને ટક્કર મારી

। (એજન્સી) સાબરકાંઠા, તા.૧૬ ।
બેફામ ગતિએ કાર ચલાવીને એક ચાલકે રાહદારીને ખતરનાક ટક્કર મારી હતી. આ ઘટના સાબરકાંઠાના હિંમતનગરની છે. જ્યાં ઉદયપુર નેશનલ હાઈવે પર ૭૦ વર્ષના વૃદ્ધ રોડ કોસ કરી રહ્યા હતા. ત્યારે જ એક ચાલક બેફામ ગતિએ આવ્યો હતો. દાદા કંઈ પણ સમયે એ પહેલાં જ તેણે એટલી જોરદાર ટક્કર મારી કે તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કારની સ્પીડ જોઈને દાદા એક વખત એને રોકાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કાર એટલી ખતરનાક સ્પીડમાં હતી કે પળવારમાં જ જીવ લઈ લીધો હતો. નડિયાદમાં સેકન્ડોના ખેલમાં બાઈક ચાલક મોતને ભેટ્યો હતો. હથમચાવી નાંખનારા દ્રશ્યો છે નડિયાદના. સંતરામ મંદિર પાછળની લેબોરેટરી નજીક અકસ્માત સર્જાયો હતો. પુરપાટ આવતો બાઈક ચાલક કાર સાથે ધડાકાભેર અથડાયો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે યોગેશ પહેલા એક વૃદ્ધ રાહદારીને

ટક્કર મારી. ત્યારબાદ તેમનું બાઈક એક ફોર્ચ્યુનર કાર નીચે ઘૂસી ગયું. અકસ્માતમાં યોગેશનું માથું ફાટી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું નડિયાદ ટાઉન પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ થયું છે કે બાઈક ચાલકની ઓવરસ્પીડ અને બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. વલસાડ જિલ્લાના ધરમપુરમાં રસ્તા પર દોડતી એક કાર અચાનક પલટી મારી ગઈ હતી. લોકોની અવરજવર વચ્ચે કાર પલટી મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. કાર પલટવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. શહેરના લક્ષ્મીનારાયણ મંદિરની સામે રોડ પર લોકોની અવરજવર હતી એ વખતે જ એક ઈકો કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી. એ દરમિયાન રોડ પર ટર્ન લેતા જ અચાનક કાર પલટી મારી ગઈ હતી.

સમાચાર પત્ર છે લોકતંત્રનો ચૌથો સ્તંભ અને પ્રાણ, જે કદે છે એક લોકતંત્રનો નિર્માણ !

CHANNEL NINE NETWORK GUJARAT

◆ ન્યૂઝ પેપર, ◆ ન્યૂઝ ચેનલ, ◆ ન્યૂઝ વેબસાઈટ

આજે જ **cnnngujarat.com** વેબસાઈટ ઉપર વિઝીટ કરો અને જોડાઈ જાઓ સમાચારની દુનિયા સાથે...

CNN

Channel Nine Network GUJARAT

Gujarati Daily News Paper

LIVE

cnnngujarat.com.in

CMYK

CMYK